

વાંચકો માટે ખાસ નોંધ :

SLEEP

વાંચકો માટે ખાસ નોંધ :

- આ કિતાબ સંપૂર્ણ નથી.
- કિતાબમાં સમયાંતરે વિષય સંબંધિત નવું લખાણ અને વિગતો ઉમેરાતી રહે છે.
- કિતાબમાં સુધારા—વધારા અને ઉમેરણકાર્ય ચાલુ છે.
- તેથી આ કિતાબને એક વાર વાંચી લીધા પછી સંતોષ ન માની લેશો અને નવી અપડેટેડ (સુધારા—વધારા અને ઉમેરણ સાથેની) કિતાબનો દર મહિને નિયમિત અભ્યાસ અને વાંચન કરવાનું ભૂલશો નહિં.
- કિતાબની તાજેતરની / લેટેસ્ટ [LATEST] આવૃત્તિ જાણવા માટે દરેક પેજના ફુટરમાં કિતાબના નામની બાજુમાં આપેલી તારીખ જોઈ લેવા વિનંતી.

બિસમીલ્હાહિ રહમાનિ રહીમ
અનુક્રમણિકા

ફ્રેમ પ્રકરણ	પેજ
૧. ઉંઘ	
૨. સવારની ઉંઘ એટલે રોજીમાં ઘટાડો	
૩. વધારે ઉંઘના નુકસાન	
૪. ઓછી ઉંઘના ફાયદા અને ફરજીલત	
૫. સૂવાનો સમય	
૬. સૂવાની જગ્યા	
૭. સૂવાની રીત	
૮. રાત્રે સૂતા પહેલાં...	
૯. સૂતા પહેલાં પઢવાની દોઆ, ઝીક્ર અને તિલાવત	
૧૦. વહેલા ઉઠી શકાતુ નથી, શું કરવું ?	
૧૧. ઉંઘ આવતી નથી !	
૧૨. વહેલી સવારે...	
૧૩. ઉંઘ અને મૌત	
૧૪. ઉંઘમાં ડરી જવું	
૧૫. રાત્રે ઉજાગરા કરવા, નકામા કાર્યો માટે જાગવું	
૧૬. ઉંઘ નશો છે	
૧૭. કૈલુલહ (બપોરની જરામાત્ર ઉંઘ)	
૧૮. ઉંઘના પ્રકાર	
૧૯. કયારેક ઉંઘ ઈબાદત કરતા બહેતર હોય છે!	
૨૦. રોજેદારની ઉંઘ	
૨૧. કુરાખાનમાં ઉંઘનો ઉલ્લેખ	

૨૨. રાત્રે જાગવાના લાભદાયક પ્રસંગો

૨૩. રેફરન્સીલ (સંદર્ભ પુસ્તકોના નામ)

અહ્લાહ તથાલા પોતાની કિતાબ કુરઆનમાં ફરમાવે છે:

અહ્લાહ તેઓના મૃત્યુ સમયે (તેમના શરીરમાંથી) નફસોને ખેંચી લે છે, અને જેઓનો મૃત્યુ સમય આવ્યો નથી તેમના નફસ તેમની ઉંઘની હાલતમાં ખેંચી લે છે, પછી જેમના મૃત્યુનો હુકમ (નિશ્ચિત) કરી ચૂક્યો છે, તેમના નફસને રોકી રાખે છે અને બાકીના (નફસ)ને એક ચોકક્સ સમય માટે (તેમના શરીરમાં) પાછા ફેરવી દે છે. ખરેખર જેઓ વિચાર કરનારા છે, તેમના માટે આમાં નિશાનીઓ રહેલી છે. (સૂરે જુમર, આયત નંબર – ૪૨)

આવો, આપણે આયતુહ્લાહ નાસીર મકારીમ શિરાજી સાહેબના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવેલી કુરાને કરીમની તફસીર, જે ‘તફસીરે નમૂના’ ના નામથી પ્રખ્યાત છે, તેની ઉર્દુ આવૃત્તિ, ભાગ-૧૧, પેજ નંબર ૧૧૨ ઉપર આપવામાં આવેલ ઉપરોક્ત આયત (સૂરે જુમર : ૪૨)ની તફસીરનો ભાવાનુવાદ અને સારાંશ જાણીએ :

- ✓ ઉંઘ મૌતની બહેન છે. તે મૌતનું એક કમજોર સ્વરૂપ છે, કારણ કે ઉંઘ દરમિયાન રૂહનો શરીર સાથેનો સંબંધ બદ્દુ ઓછો બાકી રહે છે. ઉંઘ દરમિયાન રૂહ અને શરીર વચ્ચેના મોટાભાગના સંબંધો કપાઈ જાય છે.
- ✓ ઈન્સાન શરીર અને રૂહનું મિશ્ર સ્વરૂપ છે. રૂહ બિનભૌતિક સ્વરૂપ ધરાવે છે, જેનો શરીર સાથેનો સંબંધ ઈન્સાન માટે નૂર અને જુંદગીનું કારણ બને છે.
- ✓ મૃત્યુ સમયે અહ્લાહ ઈન્સાનની રૂહ અને શરીર વચ્ચેના સંબંધને કાપી નાખે છે અને રૂહને ‘આલમે અરવાહ’ તરફ લઈ જાય છે.
- ✓ ઉંઘ સમયે પણ અહ્લાહ ઈન્સાનની રૂહને ખેંચી લે છે, પરંતુ એવી રીતે નહિં કે સંપૂર્ણપણે સંબંધ અને જોડાણ કપાઈ જાય.
- ✓ આમ, રૂહ ઈન્સાન માટે ત્રણ જુદી-જુદી પરિસ્થિતિ ધરાવે છે :

1. જાગતી વખતે : જાગતી વખતે રૂહ અને શરીર વચ્ચેનો સંબંધ જળવાઈ રહે છે
 2. ઉંઘ સમયે : ઉંઘ દરમિયાન તે સંબંધ મોટેભાગે કપાઈ જાય છે અને ઈન્સાન અર્ધમૃત જેવો બની જાય છે
 3. મૌત સમયે : મૌત સમયે તે સંબંધ સંપૂર્ણપણે કપાઈ જાય છે.
- ✓ ઉંઘ મૌતનું કમજોર સ્વરૂપ છે અને મૃત્યુ ઉંઘનું આદર્શ ઉદાહરણ છે.
 - ✓ ઉંઘ રૂહની વાસ્તવિકતાની દલીલ છે, ખાસ કરીને જ્યારે તે સ્વખન અને તેમાં પણ સાચા સ્વખનની સાથે હોય, ત્યારે તે વધારે સ્પષ્ટ થઈ જાય છે. (કારણ કે સ્વખન દરમિયાન ઈન્સાનનું શરીર પથારી ઉપર હોય છે, પરંતુ તેની રૂહ બીજે કયાંક હોવાનું અનુભવાય છે, આજ કારણે સ્વખન દરમિયાન ઈન્સાન દૂર-દૂરના સ્થળે પહોંચી ગયો હોય તેમ અનુભવે છે.)
 - ✓ ઈન્સાન આખી રાત ઉંઘ દરમિયાન મૌતના પ્રવેશધ્વારે ઉભો હોય છે. જો ઈન્સાન આ સત્ય હકીકત ઉપર વિચાર કરે, તો આ બાબત તેના માટે ‘ગફલતની ઉંઘ’ માંથી જાગૃત થઈ જવા માટે પૂરતી છે.
 - ✓ ખરેખર ! વિચાર કરનારાઓ માટે ‘ઉંઘ’ માં પણ નિશાનીઓ રહેલી છે.

(તફસીરે નમૂના, ઉર્ધ્વ આવૃત્તિ, ભાગ-૧૧, પેજ નંબર ૧૧૨, સૂરે સુન્દર, આપણ નંબર ૪૨ ની તફસીરનો ભાવાનુવાદ અને સારાંશ)

ઈમામ જૈનુલ આબેદીન (અ.સ.) ફરમાવે છે:

વખાણ છે તે મઅબુદ માટે જેણે રાતને પોશાક બનાવ્યો તેમજ ઊંઘને આરામ (આપનાર) બનાવી અને દિવસને આજુ-બાજુ ફેલાઈ જઈ (રોગી મેળવવા)નો સમય બનાવ્યો. સાચી પ્રસંશા તારા જ માટે છે કે તે મને મારી જ્વાબગાહ (ઉંઘ)માંથી જગાડયો. જો તું ચાહતે તો તે ઊંઘને હંમેશા કાયમ રહેવા દેત !

(સહીફ એ કામેલા, બુધવારે પઢવાની દોઆ)

ઉંઘ અલ્લાહની અનમોલ નેઅમત છે, જેને તેણે પોતાના બંદાઓના આરામ અને રાહત માટે બનાવી છે. ઊંઘ પછી ઈન્સાન જાગે છે, ત્યારે રૂહ શરીરના પ્રત્યેક અંગ માટે પુનઃપ્રાય બને છે, જે મૃત્યુ પછી ફરી સજીવન થવા સાથે સામ્યતા ધરાવતી રોજંદા જીવનની ઘટના છે. જે અલ્લાહ ઈન્સાનને દરરોજ સવારે ઊંઘમાંથી એટલે કે ટૂંકી મૌતમાંથી જાગૃત કરે છે તે જ શક્તિશાળી અલ્લાહ તેને મૃત્યુ પછી એટલે કે લાંબી મૌત પછી ફરી ઉભો કરશે. ઈન્સાન માટે દરરોજ સવારે ટૂંકી મૌતમાંથી જાગ્યીને પોતાના કાર્યોનો હિસાબ કરી લેવો હિતાવહ છે, જેથી કરીને મૌતની લાંબી ઊંઘમાંથી ઉઠયા પછી કષ્માં હિસાબ આપવો તેના માટે સરળ બની જાય.

વખાણને પાત્ર છે અલ્લાહ જેણે અસહાબે કહેફને ત્રણસો વર્ષ સુવડાવી રાખ્યા, છતાં કાળ (સમય)ની અસર તેઓના શરીર ઉપર થવા ન દીધી !

વખાણને પાત્ર છે અલ્લાહ, જેણે ઓઝેર પયગભરને સો વર્ષની લાંબી ઊંઘ પછી ઉઠાડયા અને તેમને દુખાડયું કે તેમનો એક જ દિવસમાં બગડી જનારો ખોરાક વર્ષો પછી પણ તાજો જ હતો અને તેમની સવારી સડીને માટી બની ચૂકી હતી, જ્યારે કે તેઓ પોતે તેજ હાલતમાં અને તેજ વયમાં બાકી હતા !

વખાણને પાત્ર છે અલ્લાહ, જેણે હિજરતની રાત્રે પોતાના વહાલા રસૂલ હજરત મૌહમ્મદ મુસ્તફા (સ. અ. વ.)ના બિસ્તર પર તેમની જગ્યાએ સૂવરાવવાના કામ માટે પણ પોતાના વલી અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ (અ. સ.)ને જ પસંદ કર્યો !

ખરેખર, વખાણને પાત્ર છે અલ્લાહ, જેને કયારેય ઝોકું (ઝોલું) કે ઊંઘ આવતી નથી !

ઝોલા ઊંઘ માટે પૂર્વભૂમિકા તૈયાર કરે છે. તે ઊંઘની પ્રસ્તાવના સમાન છે. ઝોલા દરમિયાન આંખની પાપણોનું મિલન થાય છે, અને પછી ઈન્સાન ક્રમશા: ગાઢ નિંદ્રામાં સરી પડે છે. ઊંઘ તેને પકડી પાડે છે અને તેની ઉપર પ્રભુત્વ મેળવી લે છે. ઊંઘ દરમિયાન તે હુન્યવી જીવનથી બેખબર અને અજાણ બની જાય છે. ઊંઘ દરમિયાન તેના કેટલાક ભાગો અને સંવેદના કામ કરતા બંધ થઈ જાય છે. ઊંઘ એક શક્તિશાળી સ્વરૂપ છે, જે ઈન્સાનને મજબૂતીથી પકડી લે છે અને તેને કેદી બનાવી લે છે. ઊંઘ સમયે બળવાન અને શક્તિશાળી ઈન્સાન પણ જે હાલતમાં સરી પડે છે, તે નિહાળીને ઈબરત (બોધપાઠ અને નસીહત)ની લાગણી અનુભવાય છે.

ઊંઘ આવી જાય છે, ત્યારે શરીરના આવેગો શાંત પડી જાય છે, અવયવો નિષ્ઠીય બને છે, શરીરના મહત્વપૂર્ણ ભાગો કામ કરતા અટકી જાય છે અને બાકીના અંગોનો કાર્યવેગ ધીમો પડી જાય છે. માત્ર તે અંગો, જેનું ગતિશીલ રહેવું જીવન ટકાવી રાખવા માટે અનિવાર્ય છે, ઊંઘ દરમિયાન અત્યંત નરમાશથી પોતાના કામમાં વ્યસ્ત રહે છે, જેમ કે હૃદયના ધબકારા, શ્વાસની આવન-જાવન અને મગજના કેટલાક તંતુઓ વગેરે. શરીરના અંગોને નવી તાજગી અને સ્ફૂર્તિ પ્રાપ્ત થઈ શકે તે માટેની આ પ્રાકૃતિક દેહરચના અને શારીરિક બંધારણ છે, જે અલ્લાહ તરફથી ઈન્સાનને મળેલી અમૂલ્ય ભેટ છે.

ઉંઘ શરીરની રગો માટે રાહતનું શ્રેષ્ઠ માધ્યમ છે. સમયસર અને સપ્રમાણ ઉંઘ લેવાથી શરીરની શક્તિ અગાઉની જેમ જ પોતાનું મૂળ સ્થાન ગ્રહણ કરે છે, શરીરને તાજગી અને સ્કૂર્ટિ પ્રાપ્ત થાય છે તેમજ વપરાઈ ગયેલી શક્તિ ફરીથી પાછી મળે છે. રાતની પૂરતી ઉંઘ થાકને દૂર કરે છે, તન અને મનને પ્રકૃતિલિંગ બનાવે છે, આનંદની અનુભૂતિ કરાવે છે અને કાર્યોને નવી શરૂઆત આપે છે.

ઉંઘ ઈન્સાનના સ્વાસ્થ અને સલામતી માટે અત્યંત જરૂરી પરીબળ છે. ઘણી બિમારીઓના અસરકારક ઉપાય તરીકે દર્દનિંદ્રામાં સૂવડાવી દેવામાં આવે છે, જેથી કરીને તેની રોગ પ્રતિકારાત્મક શક્તિમાં વધારો થઈ જાય. માનસશાસ્ત્રના નિષ્ણાંતો અને માનસિક રોગોનો ઈલાજ કરનારા ડોક્ટરો દર્દની ઉંઘને સામાન્ય અને નિયમિત બનાવવાના પ્રયાસ કરે છે, કારણ કે તે સિવાય માનસિક સ્થિરતા અને સંતુલન શક્ય નથી. જે વ્યક્તિ કુદરતી રીતે સામાન્ય ઉંઘ લઈ શકતી નથી, તે સુસ્તી, આણસ, નિરાશા, ચીડીયાપણું, ગુસ્સો, ઉદાસી, ગમ અને રંજ અનુભવે છે. સપ્રમાણ ઉંઘની મજા માણનાર વ્યક્તિ જાગે છે, ત્યારે અનહંદ ખુશી, આનંદ અને તાજગી અનુભવે છે. આરામદાયક એક ઉંઘ પછી કરવામાં આવતો અભ્યાસ કે સંશોધનકાર્ય અત્યંત અસરકારક નીવડે છે. પૂરતી ઉંઘ પછી શારીરિક અને માનસિક શ્રમ આનંદ આપનાર અને ઉત્સાહ વધારનાર બને છે.

ઉંઘ નશાનો એક પ્રકાર છે, જેમાં ઈન્સાનને પોતાની પણ ખબર રહેતી નથી. તે વજુને બાતિલ કરી દેનારા પરિબળોમાંથી એક છે. ઉંઘની હાલત ઈન્સાન માટે નિયમિતપણે ઉભી થાય છે, તેમણી ઉંઘના રહસ્યો હજુ સુધી સંપૂર્ણપણે ઉકેલી શકાયા નથી, ત્યાં સુધી કે એ વાત પણ સમજી શકતી નથી કે તે કઈ બાબત છે જેના કારણે ચોક્કસ સમયે શરીરના કેટલાક ભાગોનો કાર્યવિગ મંદ પડી જાય છે, જોલાની શરૂઆત થાય છે, આંખોની પાંપણ ભેગી થવા લાગે છે અને શરીર આરામ અને રાહતની માંગણી કરે છે. ટૂંકમાં એટલું જરૂર કહી શકાય કે ઉંઘ ઈન્સાનની જુંદગીમાં આવતો એક વિસ્મયકારક ફેરફાર છે, જે માનવશરીરમાં આકાર પામે છે અને તેમાં અનેક આશ્ર્યર્થજનક બાબતો રહેલી છે, જે તેના ખાલિકની હિકમતોને જાહેર કરે છે.

અલ્લાહ સુષ્ણાનહું વ તાલા પોતાની કિતાબ કુરાઅનમાં ફરમાવે છે :

અલ્લાહ કે જેણે તમારા માટે રાત બનાવી, કે જેથી તમે તેમાં સુકુન (આરામ) મેળવો અને દિવસને પ્રકાશિત બનાવ્યો. બેશક અલ્લાહ લોકો ઉપર મહાન ફરજ વાળો છે, પરંતુ મોટાભાગના લોકો શુફ્ર કરતા નથી (આભાર માનતા નથી). (સૂરે મોઅમ્રીન, ૪૦ : ૬૧)

ઉંઘ અને રાત પરસ્પર (એકબીજા સાથે) મહત્વપૂર્ણ સંબંધ ધરાવે છે, કારણ કે ઉંઘ માટે કુદરતી સમય રાતનો છે. રાહત અને આરામ સાથેની ગાઢ નિંદ્રા માણવા માટે અંધકાર જરૂરી પરિબળોમાંથી છે. અંધકાર રાહત, આરામ અને નિરાંતરનું વાતાવરણ પૂરું પાડે છે. દિવસના પ્રકાશમાં ઉંઘ આરામદાયક અને સાનુક્ણ નથી લાગતી. વાતાવરણ જેટલું અંધકારમય હોય છે, ઉંઘ તેટલી જ ગાઢ અને આરામદાયક બને છે. આજ કારણ છે કે ઈન્સાન ઉપરાંત વૃક્ષો અને પ્રાણીઓ જેવી મખ્લૂક પણ રાત્રિ દરમિયાન ઉંઘમાં વ્યસ્ત હોય છે. ખરેખર, જો અલ્લાહ દિવસને ક્યામત સુધી લંબાવી દે, તો અલ્લાહ સિવાય બીજુ કોણ છે, જે આપણા માટે રાતને લઈ આવે, જેમાં આપણે સુકુન અને આરામ મેળવીએ !?!

રાતના બીજા પણ કેટલાક અંગત ફાયદાઓ છે, જેમ કે રાતની અંતિમ ક્ષણો અલ્લાહની બારગાહમાં અંગત વાતચીત, ઈબાદત, સ્વધારણા અને નફસની કેળવણી માટેનો શ્રેષ્ઠ સમય છે. વધુમાં, જો રાત ન પડે

અને સૂર્યપ્રકાશ સતત આવતો રહે, તો વૃક્ષો, વનસ્પતિ અને પ્રાણીઓ બળીને રાખ થઈ જાય અને તેમનું મહત્વ બાકી ન રહે.

અલ્લાહ સુભાનહુ વ તાલાલા ‘ફાલેકુલ ઈસ્ભાહ’ છે, જે રાતના અંધકારમય પર્દાને ચીરીને ‘સુખુ’ ને પ્રકાશિત કરે છે.

અલ્લાહ તાલાલા પોતાની કિતાબ કુરાઅનમાં ફરમાવે છે :

‘ફાલેકુલ ઈસ્ભાહ’, અને તેણે રાતને આરામ (સુકુન) માટે અને સૂર્ય તથા ચંદ્રને ગાંશતરી (હિસાબ) માટે બનાવ્યા. તે અગ્રીજ (અને) અલીમની ‘તકદીર’ છે. (સૂરે અન્નામ, ૬ : ૮૭)

- તકદીર : નિર્માણ, અલ્લાહે નક્કી કરેલી બાબતો

તે અલ્લાહ સુખાનહુ વ તાલાલાની હિકમત સાથેની સુવ્યવસ્થા અને નિમાર્ણ છે, જેના કારણે રાત પસાર થયા પછી વહેલી સવારે પ્રકાશ અચાનક અને સંપૂર્ણપણે નથી આવી જતો. તેજ રીતે દિવસ પૂરો થયા પછી સાંજના સમયે અંધકાર એકી સાથે અને અચાનક છવાઈ નથી જતો. વહેલી સવારે અને સાંજે પ્રકાશ અને અંધકાર ક્રમશઃ ધીમે-ધીમે એકબીજાનું સ્થાન ગ્રહણ કરે છે, જેના કારણે માનવજીવનમાં વિક્ષેપ નથી પડતો. પ્રકાશ અને અંધકારનો ફેલાવો તથા પ્રસારણ મંદ ગતિએ આગળ વધે છે, જેના કારણે મખ્લૂક તેના આગમન અને વિદાય માટે તૈયાર રહે છે.

આપણે ઘણી વખત અનુભવીએ છીએ કે જ્યારે રાત્રિના સમયે પાવરકાપના લીધે અચાનક વીજળી ગુલ થઈ જાય છે, ત્યારે અચાનક અને સર્વત્ર અંધારુ થઈ જવાના કારણે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. થોડા સમય પછી જ્યારે અચાનક વીજળી આવે છે, ત્યારે પણ અચાનક પ્રકાશ આવવાના લીધે આપણે એક અલગ પ્રકારની તકલીફ અનુભવીએ છીએ. આપણી આંખો અચાનક આવી પડેલા પ્રકાશને કારણે અંજાઈ જાય છે. જો આવું વારંવાર બને, તો આંખો માટે નુકસાનનું કારણ બને છે. ‘સુખુને રૌશન કરનાર’ ‘ફાલેકુલ ઈસ્ભાહ’ અલ્લાહે ઈન્સાનને ખલેલ ન પડે, તે માટે અંધકાર અને પ્રકાશના આગમન અને વિદાયની શ્રેષ્ઠ વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે, જે માનવજગત માટે એક કિંમતી તોહફો છે.

ઉંઘ સ્વાભાવિક અને પ્રાકૃતિક દ્રિયા છે. પૂરતા પ્રમાણમાં ઉંઘ લેવાથી શરીરનો થાક દૂર થાય છે અને ફરીથી સ્ફૂર્તિ અને તાજગી મળે છે. પરંતુ એ વાતનો ઝ્યાલ રાખવો જોઈએ કે વધારે ઉંઘ ઈન્સાનના શરીર માટે અને ખાસ કરીને તેની રૂહ માટે ખૂબ જ નુકસાનકારક છે. અલ્લાહ વધારે પડતી ઉંઘ અને આહારને પસંદ નથી કરતો.

અલ્લામા મજલીસી (અ. ર.) પોતાની અમૂલ્ય કિતાબ ‘તહીબુલ ઈસ્લામ’ માં લખે છે કે :

ચાર ચીજો એવી છે જેનો થોડો હિસ્સો પણ બહુ વધારે હોય છે:

“ આગ, ઉંઘ, બિમારી અને દુશ્મની ” (તહીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૫૪)

ઈસ્લામે દરેક કામની એક ચોકક્કસ રીત અને પદ્ધતિ બતાવી છે જેનું અનુસરણ કરવાથી ઈન્સાન દુનિયા અને આખેરતના ફાયદા મેળવી શકે છે. ઈન્સાન માટે ભલાઈ એમાંજ રહેલી છે કે તે અલ્લાહે બતાવેલા માર્ગ ઉપર ચાલે અને તેણે જે સમયે જે કામ કરવાનો આદેશ આપેલ છે તે મુજબ જ તેને બજાવી લાવે. અલ્લાહે રાતને સૂવા માટે અને દિવસને કામકાજ માટે બનાવ્યા છે. દિવસભરના શ્રમ પછી ઉંઘવાનો કુદરતી સમય રાતનો છે. દિવસની ઉંઘ ઈન્સાન માટે હાનિકારક છે. હજરતે લુકમાન (અ. સ.) ને અલ્લાહે હિકમત અતા કરી હતી, તેનું એક કારણ એ પણ હતું કે હજરત લુકમાન (અ. સ.) કદીપણ દિવસે સૂતા ન હતાં.

આધુનિક તબીબી સંશોધન મુજબ સવારે મોડા ઉઠનારી વ્યક્તિ કબજીયાત અને શરદીના રોગથી પીડાતી હોય છે. મોડા ઉઠવાના કારણે તેના ચહેરા ઉપર આળસ અને સુસ્તીના ચિહ્નો નજરે પડે છે. તેના કાર્યો મંદગતિએ ચાલતા હોય છે. તેના સ્વભાવમાં ચીરિયાપણું આવે છે. સૂર્યોદય પહેલાં ઉઠવું એ કુદરતી ફ્રેમ છે. ઊંઘ, આહાર અને જાતીય વ્યવહારો જેટલા વધારીએ તેટલા વધે, માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ જ આરોગ્ય માટે લાભદાયક રહે છે.

અનુભવોથી સાબિત થયેલી વાત છે કે જે ઈન્સાન સવારે ઉઠવામાં મોહું કરે છે અથવા ઉઠીને સૂર્ય જાય છે તેના દરેક કાર્યોમાં વિલંબ થાય છે, તેની રોગીમાં સરળતા બાકી નથી રહેતી, તેના કાર્યો વિખેરાયેલા, અવ્યવસ્થિત અને ગૂંઘવાડાભર્યા (complicated) બને છે, કાર્યભાર વધતો જાય છે અને રાત્રે મોહે સુધી કામ કરવા છતાં કાર્યો પૂર્ણતા સુધી પહોંચી શકતા નથી.

સવારની ઊંઘ સમયની બરકત છીનવી લે છે, સવારના કામ સાંજ ઉપર ઠેલાય છે અને કેટલાક કાર્યો બીજા દિવસ ઉપર મુલતવી રહે છે. કેટલાક અગત્યના કાર્યો જેવા કે નખ કાપવા, બાલ-દાઢી સેટ કરવા, મૂછો કટરવી, બગલ અને કુંટી નીચેના વાળ સાફ કરવા વગેરે દિવસો સુધી ઠેલાયા કરે છે. દુનિયા અને આખેરતની સફળતા મેળવવા ઈચ્છનાર દરેક વ્યક્તિએ એ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ કે ઊંઘ, આહાર અને જાતીય વ્યવહાર ઈન્સાનના જીવનમાં ખૂબ જ મહત્વની અને ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. જો તે આ ત્રણેય બાબતોમાં બેદરકાર રહેશે, તો રોગોથી દ્યેરાઈ જવાના કારણે તેના માટે આ જીંદગીની નેઅમત કડવી બની જશે.

સવારની ઊંઘ વેપારી માટે :

- ✓ દુકાન કે ઓફિસનું કામ સવારે મોહું શરૂ થાય છે અથવા નોકરોના ભરોસે ચાલે છે.
- ✓ સમયની અનિયાભિતતાના કારણે સવારના ગ્રાહકો બીજી તરફ વળી જાય છે, પરિણામે હરીફ વેપારી આગળ નીકળી જાય છે
- ✓ નોકરો પણ મોડા આવે છે. તેમની પાસે સમયપાલન કરવી શકતું નથી.
- ✓ મોટાભાગના કાર્યો નોકરોના ભરોસે ચાલે છે, જેમાં સફળતા નહિવત હોય છે.
- ✓ શેઠ / માલિક (Boss) ધરે સૂતા હોય છે, નોકરો ઓફિસે / દુકાને સૂતા હોય છે.
- ✓ વેપાર સંચાલન (Business Management) ખામીભર્યું અને અવ્યવસ્થિત બને છે.
- ✓ આર્થિક વ્યવહારો ખામીભર્યા બને છે, માલિકની ગેરહાજરીમાં થયેલા સવારના ડિસાબોમાં ગોટાળા / ભષ્યાચાર થાય છે.

સવારની ઊંઘ નોકરીયાત / કર્મચારી માટે :

- ✓ ઓફિસે જવામાં મોહું થશે તેની ચિંતામાં ટોઇલેટ, બ્રશ, વઝુ, નમાજ, નાશ્તો, સ્નાન વગેરે જેવા રોજંદા કાર્યો અત્યંત ઝડપથી અને ફિટાફટ આટોપવા પડે છે.
- ✓ આમધૃતાં ઓફિસે સમયસર પહોંચી શકતું નથી.
- ✓ મોહું થવાના કારણે દરરોજ સવારે શેઠ / માલિક / ઉપરી અધિકારી (Boss) નો ઠપકો સાંભળવો પડે છે. માલિકના કડવા બોલ તેમજ ચહેરાના પ્રતિકૂળ અને તંગ હાવભાવને બરદાશ્ત કરવા પડે છે.
- ✓ સવારે કામ મોહું શરૂ થાય છે અને કામનો બોજ વધી જાય છે તેથી રાત્રે મોહે સુધી રોકાવું પડે છે.

સવારની ઊંઘ મેનેજર / સંચાલક / વ્યવસ્થાપક / સત્તાધીશ માટે :

- ✓ નોકરો અને સત્તાક્ષેત્ર હેડળ આવતા માણસો ઉપર અંકુશ બાકી રહેતો નથી.
- ✓ દુશ્મનો અને નીચલા સ્તરના લોકો સંચાલકની ઊંઘનો ભરપૂર ફાયદો ઉપાડે છે અને સંચાલન વ્યવસ્થામાં વિક્ષેપ ઉભો કરે છે.
- ✓ ઊંઘના કારણે આંખો બંધ હોવાથી મેનેજર / સંચાલક પોતાના કાર્ય વિસ્તાર (Region) ઉપર નજર રાખી શકતો નથી.
- ✓ સંચાલકને મૂળવતી સમસ્યાઓ અને નવા—નવા પ્રશ્નો ઉભા કરવામાં આવે છે, શાસનકાળ ઊંઘમાં પસાર થાય છે.
- ✓ વહીવટી કાર્યોમાં વિલંબ થાય છે. પ્રજા / માણસોમાં અસંતોષ અને અન્યાયની લાગણી પેદા થાય છે.
- ✓ શાસક ઊંઘમાં હોય છે, ત્યારે હલ્કા અને ઉત્તરતી કક્ષાના લોકો બેફાન બને છે, સામાન્ય લોકો ઉપર ઝુલ્ભ કરે છે, બળવો કરે છે, વિરોધનો વંટોળ ઉભો કરે છે, અને કયારેક સત્તાને ઉથલાવી મારે છે.

સવારની ઊંઘ વિધ્યાર્થી માટે :

- ✓ સ્કૂલ / કોલેજ / ટયુશન માં સમયસર પહોંચી શકતું નથી.
- ✓ સ્કૂલ બસ / રિક્ષા ઉપરી જાય છે.
- ✓ હોમવર્ક માટે સમય તંગ પડે છે, હોમવર્કનો સમય ઊંઘમાં ખર્ચાઈ જાય છે.
- ✓ શિક્ષકનો ઠપકો સાંભળવો પડે છે.
- ✓ રીઝલ્ટ સારું નથી આવતું.
- ✓ યાદશક્તિ અને ભરપૂર ક્ષમતા છતાં પાછળ રહી જવાય છે.
- ✓ અભ્યાસ, સંશોધન અને ઈલ્ભપ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સમય સવારનો છે, જે ઊંઘ પાછળ ખર્ચાઈ જાય છે.
- ✓ ભણવાની ઉમર (વય) ઊંઘમાં વેડફાઈ જાય છે.
- ✓ ઈલ્ભથી વંચિત રહેવું પડે છે.
- ✓ ઉચ્ચ ડીશ્રી કે લાયકાત પ્રાપ્ત કરી શકતા નથી.
- ✓ સમય વિતી ગયા પછી અફસોસ થાય છે કે સૂવાના બદલે અભ્યાસ કર્યો હોત, તો સારું હોત.

વિધ્યાર્થીઓ અને ઈલ્ભના ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓએ ઊંઘ બાબતે ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે વધારે ઊંઘ અને આહાર ઈલ્ભ પ્રાપ્તિના માર્ગમાં અવરોધક અને અડયણદુર્ઘતા બને છે. જો ઊંઘ ઉપર કાબુ મેળવવામાં ન આવે, તો ઈલ્ભ પ્રાપ્ત કરવા માટે રાત્રે અથવા વહેલી સવારે સમય ફાળવી શકતો નથી.

‘મદીનતુલ ઈલ્ભ’ હજરત મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) એ જેમને ‘બાબે મદીનતુલ ઈલ્ભ’ કહ્યા છે, તે ઈલ્ભમાં અલી ઈબ્નો અલી તાલીબ (અ. સ.) ફરમાવે છે :

શરીરના આરામ અને રાહતની સાથે ઈલ્ભ મેળવી શકતું નથી.

(તજલ્લીયાતે હીકમત, ઉર્દુ, પ્રકરણ : ૧૫૧, પેજ-૩૪૫, હદીસ: ૮૬)

જે તાલીમની કડવાશ ઉપર સંબ્રા નથી કરી શકતો, તે અજ્ઞાનતાના અપમાન ઉપર બાકી રહે છે.

(તજલ્લીયાતે હીકમત, ઉર્દુ, પ્રકરણ: ૧૫૧, પેજ-૩૪૬, હદીસ: ૧૦૦)

કામકાજ્ઝી પરવારીને ઈન્સાન રાત્રે ઘરે પાછો ફરે છે, ત્યારે મનોરંજન અને ફ્રેશ થવાના બહાને ટીવીની સ્વીચ ઓન કરે છે. તેના આ કામમાં તેની પત્નિ અને બાળકો પણ જોડાય છે. એક પછી એક ટીવીના કાર્યક્રમો

આગળ વધતા જાય છે અને કુટુંબના એક પદ્ધી એક સભ્યની આંખો ઉપર ઊંઘ કાબુ મેળવી લે છે. ટીવીના કાર્યક્રમો જોવામાં મશગુલ ઈન્સાન મોડી રાત્રે ચાલુ ટીવીએ જ સૂઈ જાય છે. મોડી રાત્રે સૂવાની ટેવને કારણે અવારનવાર સુષ્ણની નમાઝ કરા થઈ જાય છે અથવા ક્યારેક ફટાફટ છેલ્લી ક્ષણોમાં બે રકાત નમાઝ પઢી તરત જ સુંવાળી અને નરમ પથારી ઉપર ઊંઘને ગળે લગાડી લેવાનું પસંદ કરે છે.

મનાઈ કરેલા ચલચિત્રો (ફીલ્મો) અને સંગીતના કાર્યક્રમોને ટીવી ઉપર નિહાળ્યા પદ્ધી ઈન્સાનને કઈ રીતે ઊંઘ આવી જાય છે, જ્યારે કે મૌત તેની શોધમાં છે ?! શા માટે તે મૌતથી બેદરકાર છે જ્યારે કે મૌત પોતે તેનાથી બેદરકાર નથી !? રાત્રે ટીવી જોવામાં મશગુલ થઈ સૂઈ જતો ઈન્સાન ધારે તો વજુ કરી અલ્લાહના જીક્રમાં વ્યસ્ત રહીને પણ સૂઈ શકે છે. આમ કરવાથી તે આખી રાત જાગી ઈબાદત કરવાનો સવાબ અને વળતર પણ મેળવી શકે છે. વધુમાં તેમ કરવાથી રાત્રે આવનારી બલાઓ—બિમારીઓ અને ખરાબ સ્વખો વગેરેથી પણ પોતાને સુરક્ષિત રાખી શકે છે !

અલ્લાહ ઈન્સાનને સમયની મૂલ્યવાન નેઅમત આપીને ચકાસતો હોય છે કે તેનો બંદો સમયનો ઉપયોગ ક્યા કામમાં કરે છે, પરંતુ ઈન્સાનનો ખુલ્લો દુશ્મન શૈતાન તેને એવા વર્થ કામોમાં લગાડી દે છે જેનાથી તેને કોઈપણ પ્રકારનો ફાયદો મળતો નથી. શૈતાન ઈન્સાનને પોતાની હારનો એહસાસ પણ થવા દેતો નથી અને તેને અલ્લાહની ઈબાદતથી વંચિત રાખી સફળ થયાનો આનંદ માણે છે.

પરોઢીયા (સુષ્ણસાદીક)ના સમયે જ્યારે અલ્લાહ પોતાના ફઝલ, રહેમત, નેઅમત, બરકત, આફ્યાત, રિઝક અને માર્જીને તેના બંદાઓ વચ્ચે વહેંચતો હોય છે, ત્યારે ઈન્સાન બેદરકાર બનીને ‘ગફલતની ઊંઘ’ માં મસ્ત હોય છે. ખરેખર દુનિયા પરસ્ત લોકો એવા મુસાફરોની જેમ છે જેમને આખેરતની તરફ લઈ જવામાં આવી રહ્યા હોય છે, પરંતુ તેઓ ઊંઘમાં હોય છે !

ઈમામ સજજાદ (અ. સ.) અબુ હફ્ફા સુમાલીને ફરમાવે છે:

સૂર્ય ઉગે તે પહેલાના સમયે સૂવું નહિં. આ સમયે સૂવું હું તમારા માટે ક્યારેય પસંદ નથી કરતો, કારણ કે અલ્લાહ તાયાલા આ સમયે બંદાઓની રોજી વહેંચે છે અને જે આ સમયે સૂતો હોય છે, તે રોજીથી વંચિત રહી જાય છે. (તહીબીબુલ ઈસ્લામ, ઉર્દૂ, પેજ ૨૨૫, લેખક: અલ્લામા મજલીસી અ. ૨)

ઈમામ જાફર સાદીક (અ. સ.) ફરમાવે છે:

અલ્લાહના રસૂલ મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) એ સુષ્ણની નમાઝ પદ્ધી પોતાના સહાબીઓને પૂછ્યું:

ફલાણા—ફલાણા વ્યક્તિત્વો (સુષ્ણની) નમાઝમાં હાજર હતા ?!

સહાબીઓએ જવાબમાં ફરમાવ્યું કે તેઓ નમાઝ પઢવા આવ્યા ન હતા.

અલ્લાહના રસૂલ (સ. અ. વ.) એ ફરમાવ્યું:

શું તેઓ આવ્યા ન હતા ?! યાદ રાખો ! મુનાફીક ઈન્સાન માટે બીજી કોઈ નમાઝ અદા કરવી અધરી અને મુશ્કેલ નથી સિવાય કે આ (સુષ્ણની) નમાઝ અને ઈશાની નમાઝ !

(મુનાફીક : દિલ અને જીવાનમાં તફાવત ધરાવનાર, દંભી, ધાર્મિક હોવાનો દેખાવ કરનાર)

(સવાબુલ અઅમાલ વ ઈકાબુલ અઅમાલ, ઉર્દૂ આવૃત્તિ, પેજ નં ૪૮૮, લેખક : શૈખ સદ્ગુર અ. ૨.)

સુષ્ણસાદીક (પરોઢીયા)ના સમયે આંખોમાંથી નિકળતા આંસુઓ વડે જેના માટે પણ દોઆ કરવામાં આવે છે તેની ઉપર અલ્લાહના ફ્રોધની વર્ષા શાંત પડી જાય છે. આ એવો સમય છે જ્યારે અલ્લાહની માર્જી અને બક્ષીસના દરવાજા ખુલ્લા હોય છે, ફરીશ્તાઓની આવન—જાવન અત્યંત વધારે હોય છે અને શૈતાનનો કાબુ અત્યંત ઓછો

હોય છે. દોઆઓ જડપથી સ્વીકારવામાં આવે છે. આજ કારણ છે કે નમાજે શબની અદાયગી માટે રાતનો અંતિમ હિસ્સો, જે સુષ્ણસાદીકની સાથે જોડાયેલો હોય છે, તેને પસંદગી અને શ્રેષ્ઠતા આપવામાં આવી છે.

સુષ્ણસાદીક (પરોઢીયા)થી સૂર્યોદય સુધીના બરકતવાળા સમયે વાતાવરણ જન્નતની હવા અને ખુશબુથી મહેંકી ઉઠે છે, જન્નતના દરવાજા ખુલ્લા હોય છે, રીજકને વહેંચવામાં આવી રહું હોય છે અને દોઆઓ અલ્લાહની બારગાહમાં સ્વીકાર્ય બને છે. આજ કારણે નમાજે સુષ્ણ પછી પઢવાની દોઆઓ, ઝીક્ર, તિલાવત અને મુનાજાત એટલે કે ‘તઅકીબાતે સુષ્ણ’ અત્યંત વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ, આવા કિમતી સમયે ઈન્સાન પોતાના શરીર ઉપર ચાદર ઢાંકીને પોતાના અંગોને આરામ આપવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. ખરેખર, ખુશનસીબ છે તે ઈન્સાન જે આ કિમતી સમયનો ફાયદો ઉપાડીને અલ્લાહની અઢળક વહેંચણી મેળવવા હક્કદાર બની જાય છે !

વહેલી સવારે કુદરતનું વાતાવરણ અને આપણું મન બંને શાંત, સાત્વિક અને પ્રસન્ન હોય છે. અલ્લાહના અમુક હોશિયાર અને ચાલાક બંદાઓ આ સોનેરી તકને જડપી લે છે. તેઓ અલ્લાહની ઈબાદત માટે ઊંઘની મીઠાશનો ત્યાગ કરી પરોઢીયાના સમયે જ્યારે બધા અર્ધમૃત બની સૂતા હોય છે, અલ્લાહની મોહબ્બતમાં ઉભા થઈ જાય છે. ખરેખર ! અલ્લાહના એ બંદાઓ જેઓ પોતાની વહાલી ઊંઘ ઉપર કાબુ મેળવીને વહેલી સવારે અલ્લાહના હુકમની અદાયગી માટે ઉભા થઈ જાય છે તેમજ સુષ્ણની નમાજ પછી સૂર્ય જવાને બદલે તઅકીબાત, ઈલમ પ્રાપ્તિ તથા હલાલ રોજીની શોધ જેવા નેક કાર્યોમાં વ્યસ્ત રહે છે, તેઓ અલ્લાહની રાહમાં યુધ્ય કરનારા બહાદુર સૈનિકો સમાન છે, કારણ કે તેઓ દરરોજ સવારે જોલા અને ઊંઘ સામે યુધ્ય કરીને ‘જેહાદ અકબર’ માં ભાગ લેતા હોય છે. અલ્લાહ આવા બંદાઓને પસંદ કરે છે અને તેમની ઉપર પોતાની નેઅમતોની વૃષ્ટિ વરસાવે છે. વહેલી સવારે ઉઠવા માટે ઉપાડેલી તકલીફોના બદલામાં અલ્લાહ તેઓના દુન્યવી કાર્યોને આસાન બનાવી દે છે.

મોઅમ્રીન પોતાના દરેક કામોને આયોજનબધ્ય અને સુવ્યવસ્થિત રીતે અંજામ આપે છે. તેની રાત-દિવસની ઘડીઓ અલ્લાહની ઈતાઅતમાં પસાર થતી હોય છે. આજ કારણ છે કે સાચો મોઅમ્રીન અલ્લાહની મદદથી એવા કામોને પણ સરળતાથી અંજામ આપી શકતો હોય છે, જે કામ અન્ય લોકોની નજરમાં ખૂબ જ અધરું અને અશક્યની નજીદીક હોય છે. તે આણસ અને બેદરકારીને જડમૂળથી ઉખાડીને ફેરી દે છે, તેની ઊંઘ બહુ જ ઓછી હોય છે એટલે કે તે રાત્રે સૂવે છે અને રાત્રે જ જાગી જાય છે અને તે માત્ર ઈબાદતની શક્તિ મેળવવા પૂરતો જ આહાર લેતો હોય છે. તે હંમેશા યોગ્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. નકામી વાતો અને નકામા કાર્યોથી દૂર રહી પોતાના સમયપત્રક (schedule) ને કુરાન અને એહલેબેત(અ.સ.)ના આદેશ મુજબ શિસ્તબધ્ય અને સમયપાલક રાખે છે. આ રીતે તે બીજા લોકોની સરખામણીએ દુનિયા અને આખેરતની સફળતાના એવા શિખરોને પણ સર કરી જાય છે, જ્યાં સુધી પહોંચવું બીજા લોકો માટે એક સ્વખ સમાન હોય છે.

સુષ્ણની ફળીલત અને બરકતવાળી બે રક્ખત નમાજ તેના અંતિમ સમયે કરા થાય તે પહેલાં ફટાફટ પઢી સૂર્ય જવું ઈન્સાન માટે એક પ્રકારની ફકીરી, તંગદસ્તી અને બદનસીબી છે, કારણ કે તેમ કરવાથી ઘણી બધી નેઅમતો, ફઝલ (કૃપા), રહેમત, બરકત, આફ્યુન (સલામતી) અને રિઝક્થી વંચિત રહી જવાય છે તેમજ અલ્લાહની અઢળક વહેંચણીને જરાક એવી ઊંઘના બદલામાં ગુમાવવી પડે છે. ઉપરાંત, થોડી એવી ઊંઘ અને આરામની લાલચમાં મહત્વપૂર્ણ ઈબાદત નમાજનું માન જળવાતું નથી.

ઈમામ અલી ઈજને અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

જે નમાજની તૈયારી તેના સમય પહેલાં નથી કરતો, તે નમાજનું સન્માન નથી જાળવતો.

ઈસ્લામના દરેક આદેશમાં એક પ્રકારનું સમતોલપણું અને મધ્યમમાર્ગ જોવા મળે છે. જે રીતે વધારે સૂવાની મનાઈ કરવામાં આવી છે તેજ રીતે વધારે પ્રમાણમાં જાગવા અને ઉજાગરા કરવાની પણ મનાઈ કરવામાં આવી છે. અલ્લામા મજલીસી (અ. ર.) મૂલ્યવાન કિતાબ તહેજીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નંબર - ૨૫૫ માં લખે છે: ‘‘ જે મુખ્ય રાત્રિઓમાં ‘શબ બેદારી’ કરવાની (જાગવાની) ફરીલત વર્ણવવામાં આવી છે તે સિવાય અન્ય રાત્રિઓ દરમિયાન આખી રાત જાગવું અણગમતું અને ઘૃણાજનક (મકરૂહ) કાર્ય છે ”

વધુમાં રાત્રિ દરમિયાન કરવામાં આવતા વ્યવસાયોની પણ ટીકા કરવામાં આવી છે. જેમ કે આખી રાત કામ કરતો કારીગર કે ફેકટરીમાં રાતપાણી કરતા મજૂરો વગેરે. વર્તમાન સમયમાં કોલ સેન્ટર, હોટેલ, હોસ્પિટલ અને તેની જેવા આત્યાધુનિક રાત્રિવ્યવસાયો સાથે સંકળાયેલા કર્મચારીઓ મગરીબના સમયથી સુભજસાદીકના સમય સુધી કામમાં રોકાયેલા રહે છે. પરીણામસ્વરૂપે તેમને ઊંઘથી વંચિત રહેવા ઉપરાંત દીનના મહત્વના સ્તંભ નમાઝની અદાયગીને પણ જતી કરવી પડે છે. આ પ્રકારના કર્મચારીઓ પોતાના વ્યવસાય માટે આખી રાત જાગીને અને નમાઝને તર્ક કરીને અલ્લાહની નારાજગી અને તેના પ્રકોપ માટે હક્કદાર બને છે કારણ કે અન્ય અંગોની જેમ ઈન્સાનની આંખો પણ તેની ઉપર કેટલાક હકો ધરાવે છે. લાંબો સમય જાગવાથી અને ઉજાગરા કરવાથી આંખનો હક વેડફાઈ જાય છે.

માલ મેળવવાની લાલચમાં વધારે પ્રમાણમાં ભાગદોડ કરવાથી કામના અતિભારે બોજ અને તાણ (tension) હેઠળ રહેવું પડે છે. વધુમાં, આંખોના હકને વેડફીને ઊંઘની નેઅમત અને મીઠાશને જતી કરવી પડે છે અને રાત્રે મોડે સુધી કામમાં વ્યસ્ત રહેવું પડે છે. થોડા એવા માલની લાલચમાં રાતની મીઠી ઊંઘ અને આરામને જતો કરી દેવો એક વિચિત્ર પ્રકારની ફકીરી અને અક્કલના ઓછા હોવાનો પુરાવો છે.

ઈન્સાનની ઉભર (વધ)નો ૧/૩ ભાગ ઊંઘમાં પસાર થાય છે, કારણ કે સામાન્ય રીતે તે ચોવીસ કલાકમાં દીર્ઘ કલાક અને કયારેક ૧૦ કલાકની ઊંઘ લેતો હોય છે. વૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ વર્તમાન સમયમાં ઉત્તરતી કક્ષાના ખોરાક, અનિયમિત સમયપત્રક અને પ્રદૂષણયુક્ત વાતાવરણને કારણે આધુનિક માનવી સરેરાશ સાંઈઠ (૬૦) વર્ષનું આયુષ્ય ભોગવી રહ્યો છે, જેમાં વીસ (૨૦) વર્ષનો સમયગાળો ફક્ત ઊંઘ પાછળ ખર્ચાઈ જાય છે. શું અક્કલમંદ ઈન્સાન માટે યોગ્ય છે કે તે બાકીના ચાલીસ (૪૦) વર્ષ અને તે પણ નક્કી નથી કે પૂરા થશે જ, કારણ કે મૌત તે પહેલાં પણ આવી શકે છે, તેને ભૌતિક સંપત્તિ મેળવવાની દોડઘામમાં વેડફી નાખે ?!

નવાઈ પમાડનારી બાબત તો એ છે કે ધારો કે જો કોઈ ઈન્સાનનું આયુષ્ય સાંઈઠ (૬૦) વર્ષનું હોય, તો તે શરૂઆતના પંદર (૧૫) વર્ષ બાળવયમાં અને અંતિમ પંદર (૧૫) વર્ષ વૃદ્ધાવસ્થામાં પસાર કરે છે, જેમાં તે અત્યંત અશક્ત, બિમારીઓથી ધોરાયેલો, દવાઓથી ટેવાયેલો અને બીજાનો મોહત્તાજ હોય છે. બાકીના ત્રીસ (૩૦) વર્ષમાં દસ (૧૦) વર્ષ ઊંઘમાં પસાર થાય છે. શું તેના માટે યોગ્ય છે કે તે બાકીના વીસ (૨૦) વર્ષને પણ ‘ગફલતની ઊંઘ’ માં જ પસાર કરી નાખે ?!??!

લાંબા સમય સુધી જાગતા રહેવું અથવા ઊંઘ ન આવવી એ બંને બાબતો માનવશરીર માટે અત્યંત નુકસાનકારક અને પીડાદાયક છે. વધુ પડતા ઉજાગરા અને અનિંદ્રા ઈન્સાનને બેચેન કરી મૂકે છે, બિમારીઓને જેંચી લાવે છે અને કયારેક મૌતનું કારણ પણ બની જાય છે, આજ કારણે જ્યારે કોઈ ઉપર સખ્તી કરવામાં આવે છે, ત્યારે પીડાદાયક ઉપાય તરીકે તેને ઊંઘવા ન દેવાનું શસ્ત્ર વાપરવામાં આવે છે, જેના લીધે તેના શરીરની

પ્રતિકારાત્મક શક્તિ નબળી પડી જાય છે. વધુ પડતી લોન (કર્જ) ધરાવનાર વ્યક્તિની ઉમર (વય) દ્વારી જવાનું એક કારણ એ પણ છે કે લોનના હપ્તાની ચૂકવણીની ચિંતા તેની ઉંઘને ઓછી કરી નાખે છે, જે ક્રમશઃ તેને મૌતની નજીદીક લાવીને મૂકી દે છે.

નવાઈ પમાડનારી બાબત એ પણ છે કે જ્યારે કોઈ આકસ્મિક ઘટના બને છે, ત્યારે ઈન્સાનની ઉંઘ ઓછી થઈ જાય છે અને મોટે ભાગે તે જાગતો રહે છે. ઉંઘની સામે પ્રતિકાર કરવાની શારીરિક શક્તિ થોડા સમય માટે વધી જાય છે તેમજ ઉંઘની લાગણી અને વેગમાં ઘટાડો થાય છે. પરંતુ, તે આકસ્મિક ઘટનાની અસર ઓછી થયા પછી જ્યારે સ્થિતિ સામાન્ય અને પૂર્વવત બની જાય છે, ત્યારે શરીર પણ ઉંઘને પહેલાંની જેમ જ ચાહવા લાગે છે.

ગૈબતના વર્તમાન સમયમાં મોટા શહેરોમાં અને નગરોમાં ‘સેટરડે નાઈટ’ વિચારસરણી (concept) નું ચલણ મોટાપાયે જોવા મળે છે. ‘સેટરડે નાઈટ’ વિચારસરણી (concept) એટલે રવિવારે રજા હોવાથી શનિવારની રાત્રે મનોરંજન, નકામા કાર્યો, રમત-ગમત અને ગુનાહોમાં વ્યસ્ત રહેવું અને રવિવારનો દિવસ ઉંઘવામાં પસાર કરવો. આજ કારણે શનિવારની રાત્રે નાઈટ કલબો, ખાણીપીણીના સ્થળો, કાફી, રિસોર્ટ, હોટલો, સિનેમાગૃહો, પાર્ટી સ્પોટ, વોટર પાર્ક, ફાર્મ હાઉસ અને ફરવાના સ્થળોએ જનમેદનીનો ભારે ઘસારો જોવા મળે છે. ઉપરાંત કર્મચારીઓ – નોકરીયાત વર્ગ અને વિધ્યાર્થીઓ પણ રવિવાર એટલે ‘રજાનો અને કામ ન કરવાનો દિવસ’ એમ માની સવારે મોટા ઉઠવાનું પસંદ કરતા હોય છે. દુનિયાની ચાર દિવસની ચાંદની અને તેની ચમક-દમકને મેળવી લેવા માંગતો ઈન્સાન છેવટે પોતાના અનિયમિત સમયપત્રક અને ગુનાહોના કારણે અનેકવિધ બિમારીઓમાં દેરાઈ જતો હોય છે. વિચિત્ર અને રંગબેરંગી મિજાજમાં કરવામાં આવતી અલ્લાહની નાફરમાનીના કારણે ઈન્સાન કલ્પનામાં પણ ન આવી શકે તેવી બલાઓ, બિમારીઓ અને આફોમાં દેરાયેલો જોવા મળે છે ! ગ્રામ્યવિસ્તાર, જ્યાં શહેરની સરખામણીએ લોકો રાત્રિ દરમિયાન વહેલા સૂઈ જાય છે અને સવારે વહેલા ઉઠી જાય છે, તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન પસાર કરતા જોઈ શકાય છે.

વહેલી સવારે સૂર્યના કિરણો ધરતી ઉપર પડે છે, ત્યારે અર્ધમૂત્ર બની ગયેલી સૂચિમાં એક નવી જુંદગીનો ગ્રારંભ થાય છે. મખ્લૂકમાં એક નવીન પ્રકારનો ઉમંગ અને જોશ પેદા થાય છે. પક્ષીઓનો કલરવ ગુંજવા લાગે છે. વૃક્ષો અને વનસ્પતિમાં સૂર્યપ્રકાશને કારણે વૃદ્ધિ, વિકાસ અને ખોરાક બનાવવાની દ્રિયા વેગવંતી બને છે. લોકો ધંધા-રોજગારમાં વ્યસ્ત બને છે. સૂર્યની પહેલી કિરણ આશાની અનેક કિરણો સાથે લઈને ધરતીના પ્રાંગણને ચૂમે છે અને એક નવા દિવસની શરૂઆત થાય છે. દિવસભરની દોડભાગ પછી સૂર્ય ઢણતાની સાથે જ ધીમે-ધીમે ખામોશીની ગુંજ સંભળાવા લાગે છે, પક્ષીઓ પોતાના માળા તરફ રવાના થાય છે, માનવીની દોડભાગ મંદ બને છે, બજારો અને માર્ગો એકલતા અનુભવવા લાગે છે. ધીમે-ધીમે સાંજની ખામોશીનો અવાજ રાતની નિરવ શાંતિમાં ફેરવાઈ જાય છે અને દરેક મખ્લૂક ઉંઘ અને આરામ તરફ આગળ વધે છે. રાતનો પરદો ફક્ત ઈન્સાનો ઉપર જ નહિં, પણ ધરતી પર રહેલી સમગ્ર મખ્લૂક ઉપર પોશાકની જેમ સુરક્ષાકવચ બનીને છવાઈ જાય છે. ખરેખર, રાત અને દિવસની બનાવટ અલ્લાહની રહેમતમાંથી છે. ઊંડાણપૂર્વક વિચારીએ તો જણાઈ આવશે કે રાત – દિવસની આવન જાવન, તે દરમિયાન થતા ફેરફારો તથા ઉંઘ અને જાગૃતિ દરમિયાન બનતી ઘટનાઓમાં ઘણી નિશાનીઓ રહેલી છે.

અલ્લાહ તાદ્વાલા પોતાની કિતાબ કુરાયાનમાં ફરમાવે છે :

તે કે જેણો તમારા માટે રાત બનાવી કે તેમાં તમે સુકુન (આરામ અને રાહત) મેળવો તેમજ દિવસને પ્રકાશ આપનાર બનાવ્યો. બેશક તેમાં ચોકક્સપણે એ કૌમ માટે નિશાનીઓ રહેલી છે જેઓ સાંભળે છે. (સ્વરેધુનુસ, ૧૦ : ૬૭)

૨. સવારની ઉંઘ એટલે રોજીમાં ઘટાડો

૧. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:

સવાર (સુષ્ણ)ના સમયે સૂવું મનહુસ (નુકસાનકારક) છે, તેનાથી રોજી ઓછી થાય છે, રંગ પીળો (ઝીકો) પડી જાય છે અને ચહેરો બદસૂરત થઈ બદલાઈ જાય છે. આ સમયે સૂર્ય જવું એટલા માટે મનહુસ (નુકસાનકારક) છે કે અલ્લાહ તથાલા સુષ્ણસાદીક (પરોઢિયા)થી સૂર્ય ઉગે તે સમય દરમિયાન રોજીની વહેંચણી કરે છે. ખબરદાર ! આ સમયે કદી સૂવું નહિં. ઈસરાઈલના વંશજો (બની ઈસરાઈલ) માટે શેકેલી મુરદી (ફ્રાઈડ ચીકન) અને અન્ય એક વાનગી (તરન્જબીન) આજ સમયે આવતી હતી. જે આ સમયે સૂર્ય રહેતો, તેને આ હિસ્સો મળતો ન હતો.

૨. ઈમામ અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે:

સૂર્યોદય (સૂર્ય ઉગે તે) પહેલાંના સમયે અને નમાજે ઈશા પહેલાં સૂવાથી ગરીબી (ફ્કીરી)માં વધારો થાય છે.

૩. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે:

દિવસના પ્રથમ ભાગ (સવાર)માં સૂવું અજ્ઞાનતા અને ફક્ર (તંગી) છે, મધ્યભાગમાં સૂવું એટલે કે ક્રૈલુલહ (બપોરનો જરાક એવો આરામ) નેઅમત છે, અસ્ર (સાંજ) ના સમયે સૂવું મુખ્યાઈ છે તથા મગરીબ અને ઈશાની વચ્ચે સૂવું રીજકથી વંચિત કરનારી બાબત છે.

૪. ઈમામ સજજાદ(અ.સ.) અખુ હમ્રા સુમાલીને ફરમાવે છે:

સૂર્ય ઉગે તે પહેલાંના સમયે સૂવું નહિં. આ સમયે સૂવું હું તમારા માટે કયારેય પસંદ નથી કરતો, કારણ કે અલ્લાહ તથાલા આ સમયે બંદાઓની રોજી વહેંચે છે અને જે આ સમયે સૂતો હોય છે, તે રોજીથી વંચિત રહી જાય છે.

૫. અલ્લાહ તથાલા પોતાની કિતાબમાં ફરમાવે છે :

ફલ મુક્સેમાતે અમ્રા

પછી તે ફરીશ્તાઓની કસમ, જેઓ કાર્યો (અભ્ર)ની વહેંચણી કરનારા છે. (સૂરે જારેયાત, આયત નંબર ૪)

ઈમામ અલી રજા (અ.સ.)એ ઉપરોક્ત આયત સમજાવતા ફરમાવ્યું :

(અહિં) તેનો અર્થ (એ) ફરીશ્તાઓ છે, જેઓ તુલુએ ફજ (સુષ્ણ સાદીક) અને સૂર્યોદય વચ્ચે રોજીની વહેંચણી કરે છે, તેથી જે આ સમયે સૂતો રહ્યો, સમજ લેજો કે તે રિઝક (રોજી)થી સૂર્ય રહ્યો (રોજીથી વંચિત રહ્યો) !

૩. વધારે 'ઉંઘ' ના નુકસાન

૧. ઈમામ અલી ઈબ્ને અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :
ઉંઘ કેટલી ખરાબ ચીજ છે, જે ટૂંકી ઉમરને ઘટાડે છે અને વધારે સવાબનો અંત લાવે છે.
૨. ઈમામ અલી ઈબ્ને અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :
જે રાત્રે બહુ વધારે સુવે છે તે એવા અમલને ખોઈ બેસે છે જેની ભરપાઈ / પુરતી દિવસે કરી શકતી નથી.
૩. ઈમામ અલી ઈબ્ને અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :
ખરાબ થાય સૂવાવાળાનું ! તે કેટલા નુકસાનમાં છે ! તેણે પોતાની ઉમર (વય) તો ઘટાડી જ નાખી, એટલું જ નહી પણ તેના સવાબ અને વળતર પણ ઓછા થઈ ગયા !
૪. ઈમામ અલી ઈબ્ને અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :
વધારે ખોરાક અને વધારે ઉંઘ નફસને ખરાબ કરી નાખે છે અને નુકસાનનું કારણ બને છે.
૫. ઈમામ હસન અસ્કરી (અ.સ.) ફરમાવે છે :
જે વધારે ઉંઘશે, તે પરેશાન / હેરાન કરનારા સ્વખ જોશે.
૬. ઈમામ મુસા કાજીમ (અ.સ.) ફરમાવે છે :
તમારી આંખો માટે વધારે સૂવાની આદત ન પાડો કારણ કે અલ્લાહનો આભાર માનવામાં આંખ જેટલું ઓછું શરીરનું બીજુ કોઈ અંગ નથી.
૭. મેઅરાજમાં અલ્લાહ તાલાબે પોતાના પયગમ્બર (સ. અ. વ.) ને જે વાતો કહી તેમાં આ પણ છે :
દુનિયાનો બંદો એ છે જેનું ખાવું, હસવું, ઉંઘવું અને ગુસ્સો વધારે હોય છે અને તે ઓછો ખુશ હોય છે. તે જેની સાથે બુરાઈ કરે છે, તેને માફ નથી કરતો અને જે માફી માગે છે, તેની (માફી) સ્વીકારતો નથી.
૮. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :
ખરેખર અલ્લાહ વધારે સૂઈ રહેનાર અને મોટેભાગે નવરા (બેકાર) બેસી રહેનારને દુશ્મન રાખે છે.
૯. ઈમામ અલી ઈબ્ને અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :
જે પોતાના અને બીજાના અસ્તિત્વને જાળવી રાખવા માગતો હોય, તેણે ઉંઘ ઓછી રાખવી, વહેલી સવારે ઉઠવું અને સ્ત્રીઓની સંગત અને તેઓ સાથે હળવું – મળવું મર્યાદીત રાખવું જોઈએ.
૧૦. અલ્લાહના રસૂલ (સ. અ. વ.) ફરમાવે છે :
સુલૈમાન પયગમ્બરના માનનીય માતા તેમને કહેતાઃ
રાત્રે વધારે સૂંઠું નહિં, કારણ કે રાત્રે વધારે સૂઈ રહેનાર વ્યક્તિ ક્યામતના દિવસે ફરીર હશે.
૧૧. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :
હજરત મુસા (અ.સ.) એ અલ્લાહ તાલાબને વિનંતી–આજીજ (મુનાજાત) કરી:
પરવરદિગાર ! તું તારા બંદાઓમાં સૌથી વધારે દુશ્મન કોને રાખે છે ?!
અલ્લાહ તાલાબે ફરમાવ્યું :
૧૨. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :
એક મલક (ફરિશતા)ને નિયુક્ત કરવામાં આવ્યો છે, જે અવાજ આપીને કહે છે કે જે શખ્સ નમાઝ પદ્ધયા વિના અદ્ધી રાત સુધી સૂઈ જાય, તો અલ્લાહ તેને ઉંઘ નસીબ ન કરે !

૧૩. અલી ઈબને અભી તાતીબ (અ.સ.) ફરમાવે છે :

દુનિયા પરસ્ત લોકો એવા મુસાફરોની જેમ છે જેમને (આખેરતની તરફ) લઈ જવામાં આવી રહ્યા હોય અને તેઓ સૂતા હોય.

૧૪. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

સૌથી પહેલી ચીજો, જેના વડે અલ્લાહની નાફરમાની કરવામાં આવી, તે છ (૬) છે :

1. દુનિયાની મોહબ્બત
2. સત્તાની મોહબ્બત
3. ખોરાકની મોહબ્બત
4. સ્ત્રીની મોહબ્બત
5. ઊંઘની મોહબ્બત
6. સુખ-સમૃદ્ધિની મોહબ્બત

૧૫. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

અલ્લાહને બે ચીજો સૌથી વધારે નાપસંદ (અષાગમતી) છે:

- વધારે ઊંઘ
- વધારે નવરા (બેકાર) રહેવું

૧૬. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

વધારે સૂવાથી દુનિયા અને આખેરતની ખૂબી હાથમાંથી જતી રહે છે.

૪. ઓછી 'ઉંઘ' ના ફાયદા અને ફરજીલત

૧. હિન્દુ મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) ફરમાવે છે :

જે અલ્લાહની યાદ અને તેની પ્રશંસા વધારે પ્રમાણમાં કરે છે, અને જેનું ખાવું-પીવું અને સૂવું ઓછા પ્રમાણમાં હોય છે, ફરિશ્તાઓ તેમના માટે આતુર હોય છે.

૨. ઈમામ અલી ઈજને અબી તાલીબ (અ. સ.) ફરમાવે છે :

જ્યારે અલ્લાહ સુભાનહુ કોઈ બંદાની સુધારણાનો ઈરાદો કરે છે, તો તેને ઓછી વાત, ઓછો ખોરાક અને ઓછી ઉઘનું 'ઈલહામ' કરે છે.

• ઈલહામ : અલ્લાહ તરફથી દિલમાં ઉદભવેલી વાત કે વિચાર, આંતરિક પ્રેરણ અને પ્રોત્સાહન

૩. ઈમામ અલી નકી (અ. સ.) ફરમાવે છે :

જાગતા રહેવા પછી ઉંઘ ખૂબ જ સારી (મીઠી) લાગે છે, અને ભૂખ્યા રહેવું જમવાની મજા (આનંદ) વધારે છે.

૪. હિન્દુ મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) ફરમાવે છે :

ત્રણ કાર્યો એવા છે જેને અલ્લાહ પસંદ કરે છે :

- ✓ ઓછું બોલવું
- ✓ ઓછું સ્ફૂર્તિ
- ✓ ઓછું ખાવું

ત્રણ કાર્ય એવા છે જેને અલ્લાહ પસંદ કરતો નથી :

- ✓ વધારે બોલવું
- ✓ વધારે સ્ફૂર્તિ
- ✓ વધારે ખાવું

૫. ઈમામ જઅફર સાદીક (અ. સ.) ફરમાવે છે:

ક્યામતના દિવસે બધી આંખો રડતી હશે સિવાય કે ત્રણ આંખો :

- ✓ અલ્લાહના ઉરથી રડનાર આંખો
- ✓ અલ્લાહ માટે જાગનાર આંખો
- ✓ મનાઈ કરેલી ચીજો જોવાથી દૂર રહેનાર આંખો

૬. ઈમામ અલી ઈજને અબી તાલીબ (અ. સ.) ફરમાવે છે :

અલ્લાહ સુભાનહુ વ તતાલાની યાદમાં આંખોનું જાગતા રહેવું શ્રેષ્ઠ ઈલાદત છે.

૭. અલ્લાહ તતાલા પોતાની કિતાબ કુરાનમાં ફરમાવે છે :

બેશક મુત્તકીઓ જન્નતોમાં અને નેઅમતોમાં હશે.

જે કાંઈ તેઓના પરવરદીગારે તેઓને આપશે તેને (ખુશીથી) લેતા હશે. (કારણ કે) બેશક તે અગાઉ તેઓ એહસાન (નેકી અને ભલાઈ) કરનારા હતાં.

તેઓ રાતના બહુ થોડું ઉંઘતા હતાં.

અને સેહર (સુષ્ણસાઈક / પરોઢીયા)ના સમયે તેઓ ઈસ્તિગ્ફાર કર્યા કરતા હતાં.

અને તેઓના માલમાં ‘સાઈલ’ અને ‘મહરૂહ’નો હક રહેતો હતો.

૫. સૂવાનો સમય

૧. ઈમામ જઅફર સાદીક (અ.સ.) એ તેમના ગુલામને કોઈ કામ માટે મોકલ્યો. તેને આવતાં વાર લાગી એટલે ઈમામ (અ.સ.) પોતે તેને શોઘવા નીકળ્યા, તો જોયું કે તે સૂઈ રહ્યો છે. આપ(અ.સ.) તેની પાસે બેસી ગયા અને તેના ઉઠવાની રાહ જોવા લાગ્યા. જ્યારે તે ઉઠ્યો, તો આપ(અ.સ.)એ ફરમાવ્યું:
તું દિવસે પણ સૂવો છો અને રાત્રે પણ ?!?! રાત તમારા આરામ માટે છે અને દિવસ કામ કરવા માટે છે.
૨. ઈમામ અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે:
કેટલીક બાબતો ફક્ર (તંગી – ગરીબી) પેદા કરે છે અને કેટલીક બાબતો તવંગરી (માલદારી) લઈ આવે છે.
ફક્ર (તંગી – ગરીબી) ને પેદા કરનારી આ સોણ (૧૬) ચીજો છે:
 ૧. કરોળિયાના જાળા ધરમાં રહેવા દેવા.
 ૨. બાથરૂમ (સ્નાનગૃહ)માં પેશાબ કરવું.
 ૩. જનાભતની હાલતમાં કંઈ ખાવું – પીવું.
 ૪. વાંસની લાકડીથી ખિલાલ કરવો. (દાંતમાં ભરાઈ ગયેલો કચરો કાઢવો)
 ૫. ઉભા–ઉભા માથું ઓળવું.
 ૬. ઝાંકું વાળીને કચરો ધરમાં જ રહેવા દેવો.
 ૭. જૂઠી કસમ ખાવી.
 ૮. જીના (વ્યાખ્યાર) કરવો.
 ૯. લાલચ જાહેર કરવી.
 ૧૦. મગરીબ અને ઈશાના સમય દરમિયાન સૂવું .
 ૧૧. સુષ્ણસાદીક (પરોઢિયા)ના સમયથી લઈને સૂર્ય ઉગે ત્યાં સુધીના સમય દરમિયાન સૂવું.
 ૧૨. વધારે પ્રમાણમાં જૂઠું બોલવું.
 ૧૩. રાગ વાળા ગીતો સાંભળવા.
 ૧૪. રાતે ભાંગવા આવનારને આચ્યા વિના પાછો ફેરવી દેવો.
 ૧૫. અંદાજા (હિસાબ)થી વધારે ખર્ચ કરવો.
 ૧૬. સગા–સંબંધીઓ સાથે ખરાબ વ્યવહાર રાખવો.તવંગરી લાવનારી–માલ વધારનારી આ સત્તર (૧૭) ચીજો છે:
 ૧. ઝોહર અને અસ્રની નમાજ મેળવીને પછ્યી.
 ૨. મગરીબ અને ઈશાની નમાજ એક સાથે પછ્યી.
 ૩. સુષ્ણ અને અસ્રની નમાજ પછી ‘તઅકીબાત’ પછ્યી
 ૪. સગા–સંબંધીઓની સાથે નેક વ્યવહાર રાખવો.
 ૫. ધરના આંગણામાં ઝાંકું વાળવું.
 ૬. પોતાનો માલ ઈમાની ભાઈઓ સાથે વહેંચીને ખાવો.
 ૭. વહેલી સવારે રોજી માટે નીકળવું.

8. બહુ જ વધારે ઈસ્ટિગફાર કરવો.
 9. લોકોના માલમાં ખ્યાનત (ગોલમાલ) ન કરવી.
 10. સાચી વાત કહેવી.
 11. અજાન આપનારના શબ્દોને દોહરાવવા.
 12. ટોઈલેટ (લેટરીન – જાજુ)માં વાતો ન કરવી.
 13. દુનિયા મેળવવામાં લાલચ ન કરવી..
 14. જે શખ્સ મારફત કોઈ નેઅમત મળતી હોય, તેનો આભાર માનવો.
 15. જમતાં પહેલાં હાથ ધોઈ લેવા.
 16. દસ્તરખાન (સુફરા) ઉપર પડી ગયેલા કણ, દાઢા, ટુકડા અને રેસા ઉપાડી (વીણી) ખાઈ જવા.
 17. દરરોજ ત્રીસ વખત ‘સુષ્ણાનલ્લાહ’ કહેવું કારણ કે જે શખ્સ તેને પદ્ધશે, અલ્લાહ તેને સીતેર પ્રકારની બલાઓથી બચાવી લેશે, જેમાંની નાનામાં નાની ચીજ ફક્ક (ગરીબી, તંગી) છે.
- ✓ ‘તઅકીબાત’ એટલે નમાજ પદ્ધી પઢવામાં આવતી દોઆઓ, તિલાવત અને અલ્લાહનો લિફ્ક
3. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

અય મુફ્જુજુલ ! તમે એ કાર્યો વિષે વિચારો કે ઈન્સાન માટે બનાવવામાં આવ્યા છે, જેમ કે સ્વાદ અને ઊંઘ....! જો ઈન્સાન પોતાના શરીરના આરામ અને રાહત માટે તથા શરીરના અંગોને એકત્ર કરવાના હેતુ માટે પોતાની મરજી મુજબ ઊંઘવા લાગેત, તો આ બાબત તેના માટે બોજારુપ અને અસહ્ય બની જાત અને (ઊંઘ) તેની ઉપર કાબુ મેળવી લેત અને આ કારણે તેનું શરીર કમજોર અને નિર્બણ થઈ જાત.

 4. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

ત્રણ આદતો એવી છે કે તે જે કોઈ શખ્સમાં હશે, અલ્લાહ તથાલા તેને દુશ્મન રાખશે :

 1. રાત્રે જાગ્યા વિના દિવસે સૂવું
 2. અયોગ્ય સ્થાને હસતું
 3. પેટ ભરેલું હોવા છતા ખાવું. 5. અલ્લાહના રસૂલ (સ. અ. વ.) ફરમાવે છે:

ધરતી ત્રણ કારણે અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરે છે:

 1. નાજાએજ ખૂન જે તેની ઉપર પાડવામાં આવે છે
 2. વ્યલિચાર પદ્ધી કરવામાં આવતું ગુસ્લનું પાણી જે જમીન ઉપર પડે છે
 3. એ વ્યક્તિ જે (સુષ્ણ સાદીકના સમયથી) સૂર્ય ઉગે તે પહેલાં સૂતો હોય છે 6. અલ્લાહના રસૂલ મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) એ નીચેના કાર્યોની મનાઈ ફરમાવી છે :
 - ખોટા સ્વખ્નો રચી – ઘડી કાઢવા
 - મુરદ્યા (કૂકડા)ને ગાળ આપવી, કારણ કે તે નમાજના સમયે જગાડે છે 7. હઝરત રસૂલેખુદા (સ. અ. વ.) જ્યારે ગરમીના કારણે બહાર સૂવાની શરૂઆત કરતા હતાં, તો ગુરુવારે નીકળતા હતાં અને હવા ઠંડી થઈ જતી ત્યારે (શિયાળો શરૂ થાય ત્યારે) અંદર સૂવાની શરૂઆત કરતા, તો શુક્રવારથી આરંભ કરતા હતાં.

૬. સૂવાની જગ્યા

૧. અલ્લાહના રસૂલ મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) એ ત્રણ પ્રકારના લોકો ઉપર લઅનત કરી છે :
- ✓ એકલા ખાનાર
 - ✓ એકલા મુસાફરી કરનાર
 - ✓ મકાનમાં એકલા સૂનાર
- એકલા સૂનાર માટે પાગલ થઈ જવાનો ભય રહેલો છે.
૨. અલ્લાહના રસૂલ હિન્દુ મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) એ એવી અગાસી ઉપર સૂવાની મનાઈ ફરમાવી છે જેની (ચાર) દિવાલો ન હોય અને એમ પણ ફરમાવ્યું છે કે જે શખ્સ એવી અગાસી ઉપર સૂઈ જાય જેને ચાર દિવાલો ન હોય, તો તે અલ્લાહના રક્ષણથી બહાર છે.
૩. ઈમામ જાફર સાદીક (અ. સ.) ફરમાવે છે:
- અગાસી ઉપર એકલા સૂવું અથવા એવી અગાસી ઉપર સૂવું જેને દીવાલો ન હોય એ અણગમતું અને ધૃષ્ણાજનક (મકરૂહ) છે. પૂરુષો અને સ્ત્રીઓ બંને માટે આ હુકમ એકસમાન છે.
લોકોએ પૂર્ણયું: અય રસૂલેખુદા (સ. અ. વ.) ના પુત્ર ! જો અગાસીની ત્રણ બાજુ દીવાલ હોય, તો પૂરતું છે ?!
- આપ(અ. સ.) એ ફરમાવ્યું: નહિં ! ચારે તરફ દીવાલ હોવી જોઈએ.
(રીવાયતો મુજબ અગાસીની દીવાલની ઉચ્ચાઈ ઓછામાં ઓછી સવા ગાજ એટલે કે અંદાજે ત્રણ ફૂટ અથવા બે ગાજ એટલે કે અંદાજે સાડા ચાર ફૂટ હોવી જોઈએ)
૪. અલ્લાહના રસૂલ (સ. અ. વ.) ફરમાવે છે :
- સૂતી વખતે તમારી પથારી ખંખેરી લો. જો તેમાં કોઈ નુકસાન પહોંચાડનાર જાનવર / જંતુ દુસી ગયું હશે, તો નીકળી જશો અને તમે નુકસાન (ઇજા)થી બચી જશો.
૫. ઈમામ જાફર સાદીક (અ. સ.) ફરમાવે છે :
- ઇન્સાનને એક બિસ્તરની પોતાના માટે, એક પોતાની પત્નિ માટે અને એક બિસ્તરની મહેમાન માટે જરૂરિયાત હોય છે, તેનાથી વધારે શૈતાનનો માલ છે.
૬. યાદ રાખવું જોઈએ કે ઉંઘમાં અને જાગતી વખતે સૂર્યની તરફ મોહું (ચહેરો) રાખીને લાંબા થવું કે બેસવું મકરૂહ છે.
- અમીરુલ મોઅમેનીન અલી (અ. સ.) ફરમાવે છે :
- જે શખ્સ તડકામાં બેઠો હોય, તેણે સૂર્યની તરફ પીઠ ફેરવી લેવી, કારણ કે સૂર્યની તરફ મોહું (ચહેરો) રાખીને બેસવાથી ઘણી બધી આંતરિક બિમારીઓ પેદા થઈ જાય છે.
- અન્ય એક હદીસમાં છે કે સૂર્યની તરફ મોહું (ચહેરો) ન રાખો, કારણ કે તેના લીધે....
- તાવ જોશમાં આવે છે. (તાવ ઉણાળો મારે છે)
 - ચહેરાનો રંગ બદલાઈ જાય છે

- કપડાં જૂના થઈ જાય છે
 - આંતરિક બિમારીઓ પેદા થાય છે
૭. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :
- કોઈપણ પ્રકારના અવરોધ કે અંતર વિના બે સ્ત્રીઓનું એક જ ચાદર નીચે સૂવું જાએઝ નથી (શુટ નથી), અને જો તેઓ એમ કરે, તો તેમને અટકાવવામાં આવે અને રોકવા છતાં તેણી બંને તે રીતે (સાથે) સુવે, તો તેણી બંનેને શરીરાતના નિયમ મુજબ કોડા ફટકારવામાં આવે, અને ફરી જો આવું કૃત્ય કરે, તો ફરી વખત શરીરાતના નિયમ મુજબ કોડા ફટકારવામાં આવે, અને આમ છતાં જો તેઓ દુર ન રહે, તો ત્રીજી વખતે તેઓને કલ્યાણ કરી નાખવામાં આવે.
૮. આયતુલ્લાહ સૈયદ અલી હુસૈની સીસ્તાની સાહેબની તવજીહુલ મસાઈલ, મસઅલા નંબર : ૮૨૭ મજબૂરીની હાલત સિવાય મર્સ્ઝદમાં સૂવું મકરૂહ છે,....
૯. હિન્દુ રસૂલેખુદા (સ. અ. વ.) ફરમાવે છે :
- ત્રાણ કાર્યો એવા છે કે તેના કરનાર માટે એવો ભય રહેલો છે કે તે પાગલ થઈ જાય !
1. કષ્ટસ્તાનમાં લેટરીન (જાજરૂ) જવું
 2. એક મોજુ પહેરીને રસ્તા ઉપર ચાલવું
 3. મકાનમાં એકલા સુવું

૭. સૂવાની રીત

૧. ઈમામ અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે:

કોઈ શખ્સે ઉધા ન સૂવું જોઈએ. જો કોઈને ઉધા સૂતેલા જુઓ તો તેને જગાડો અને તેને ઉધા કદીપણ ન સૂવા દો. જ્યારે કોઈ શખ્સ સૂવા ઈચ્છતો હોય, તો તેણે જમણો હાથ જમણા ગાલ નીચે રાખી દેવો કારણ કે તેને ખબર નથી હોતી કે તે જીવતો ઉઠશે કે નહીં !

૨. અહ્લાહના રસૂલ (સ. અ. વ.) ફરમાવે છે :

..... પઢી ઈસા (અ.સ.) ત્યાંથી બીજા એક શહેરમાં ગયા. ત્યાંના લોકોના દાંત પડી ગયા હતા અને ચહેરા સોજી ગયા હતા. લોકોએ ઈસા (અ.સ.) ને આ બાબતે ફરિયાદ કરી.

ઈસા (અ.સ.) એ ફરમાવ્યું :

જ્યારે તમે લોકો સૂવો છો, તો દાંત ઉપર દાંત દબાવીને સૂવો છો. આ રીતે (સૂવાથી) જે શ્વાસ અંદર જાય છે તેને બહાર નીકળવાનો માર્ગ નથી મળતો અને તે દાંતના મૂળને નબળા અને ખરાબ કરી દે છે. તેથી તમે દાંતને એકબીજા ઉપર દબાવીને ન સૂતા.

તે લોકોએ એ પ્રમાણે આદત કેળવી લીધી અને તેમની ખરાબીઓની સુ ધારણા થઈ ગઈ.

૩. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

જો તમે કોઈને ઉધા પડીને સૂતેલો જુઓ, તો તેને જગાડી દો.

૪. ઈમામ અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) એ સલમાન ફારસી(ર.અ.) અને અબુજર ગફફારી(ર.અ.) ને ફરમાવ્યું:

આંખો દુઃખતી હોય, તેવા સમયે ડાબા પડખે સૂવાથી અને ખજૂર (ખારેક) ખાવાથી દૂર રહેવું.

૮. રાત્રે સૂતા પહેલાં...

૧. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

ઇન્સાનના શરીરમાં ‘ઈશા’ નામની એક નસ છે. જે શખ્સ રાત્રે કંઈ જમતો નથી, તેના માટે આ નસ ‘સુજ્હ’ સુધી બદદોઆ કરતી રહે છે કે :

“અલ્લાહ તને એવી રીતે ભૂખ્યો રાખે, જેવી રીતે તે મને રાખી અને અલ્લાહ તને એવી રીતે તરસ્યો રાખે જેવી રીતે તે મને તરસી રાખી..”

આથી, જરૂરી છે કે રાતનું ભોજન તર્ક ન કરવું, ભલે પછી રોટલીનો એક ટુકડો અને પાણીનો એક ઘૂંઠ જ કેમ ન હોય.

૨. અલ્લાહના રસૂલ (સ. અ. વ.) ફરમાવે છે :

રાત્રે સૂતી વખતે ચીરાગ (મીષાબતી / દીવો / આગ) ઓલવી નાખો, એવું ન થાય કે ઉદર બત્તીને જેંચી જાય (પાડી નાખો) અને ધરમાં આગ લાગી જાય !

[રાત્રે વીજકાપ હોય ત્યારે તેમજ ગ્રાભ્ય અને અવિકસીત વિસ્તારો, જ્યાં વીજળીની સુવિધા પ્રાપ્ય નથી, ત્યાંના લોકો માટે વધારે લાગુ પડે છે.]

૩. ઈમામ અલી ઈજને અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે:

સૂતા પહેલાં કુદરતી હાજરે (પા'ખાના / ટોઈલેટ / બાથરૂમ) માં જરૂર જઈ આવવું અને પછી સૂવું.

૪. અલ્લાહના રસૂલ (સ. અ. વ.) ફરમાવે છે:

સૂતી વખતે હાથ ખોરાકવાળા અને ચીકણા ન હોવા જોઈએ નહીંતર શયતાન તમારી ઉપર કાબુ મેળવી લેશે તેમજ જો આવો શખ્સ પાગલ થઈ જાય, તો તેના માટે તે પોતે જ દોષિત ગણાશે. સૂતી વખતે તમારા બાળકોના હાથ—મો ધોવરાવી લો નહીંતર શૈતાન તેઓના હાથ અને મોઢાને સુંધશે અને તેઓ ડરી જશે.

૫. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:

જે શખ્સ વજુ કરીને સૂવા માટે લાંબો થાય, તેનું બિસ્તર મસ્જિદ સમાન છે. જો સૂતા પછી યાદ આવે કે વજુ કર્યું નથી, તો પથારી ઉપર તયભુમ કરી લેવું કારણ કે વજુ અથવા તયભુમની સાથે પથારી ઉપર અલ્લાહને યાદ કરતાં સૂવું નમાજ પઢવા સમાન ગણાશે.

૬. ઈમામ અલી ઈજને અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

મુસલમાને જનાબતની હાલતમાં સૂવું ન જોઈએ તેમજ વજુ કર્યા વગર સૂવું પણ યોગ્ય નથી, જો ગુસ્લ કે વજુ માટે પાણી ન હોય, તો પાક માટી ઉપર તયભુમ કરી લેવું કારણ કે ઊંઘ દરમિયાન મોઅમ્મિનની રૂહ આસમાન ઉપર જાય છે અને અલ્લાહ તરફથી તેને સ્વીકૃતિનો દરજજો પ્રાપ્ત થાય છે તેમજ તેની ઉપર રહેમત અને બરકત ઉતરે છે. હવે જો તેને મૌત આવી ગઈ, તો ત્યાં જ તેને રહેમતની નજીદીક જગ્યા

મળી જાય છે, અથવા (જો જીવતો રહે તો) તેના અમીન ફરીશ્તાઓની ઓળખ તે મોઅમીનને તેના શરીર તરફ પાછી ફેરવી દે છે.

૭. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

ચાર ચીજો (જોવા)થી ચહેરા ઉપર રોનક આવે છે :

1. ખૂબસૂરત ચહેરો

2. વહેતું પાણી

3. હરીયાળો વિસ્તાર (greenery)

જાગતી વખતે આ (ઉપરોક્ત) ત્રણ ચીજો જોવાથી અને સૂતી વખતે

4. સૂરમો લગાવવાથી

૮. એક દિવસ અલ્લાહના રસૂલ હઝરત મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) એ પોતાના સહાબીઓને ફરમાવ્યું :

✓ તમારામાંથી એવું કોણ છે, જે આખુ વર્ષ સતત રોજા રાખે છે?

જનાબે સલમાને ફારસી (અ. ર.) એ જણાવ્યું :

યા રસૂલુલ્લાહ (સ. અ. વ.) ! હું છું !

✓ પછી આપ (સ. અ. વ.) એ પૂછ્યું :

તમારામાં એવું કોણ છે જે આખી રાત જાગી ઈબાદત કરે છે?

જનાબે સલમાને ફારસી (અ. ર.) એ જણાવ્યું :

યા રસૂલુલ્લાહ (સ. અ. વ.) ! હું છું !

✓ પછી આપ(સ. અ. વ.) એ સહાબીઓને સંબોધન કરતા પૂછ્યું:

તમારામાંથી એવું કોણ છે જે દરરોજ એક કુરઆન પૂર્ણ કરે છે ?

જનાબે સલમાને ફારસી (અ. ર.) એ જણાવ્યું :

યા રસૂલુલ્લાહ (સ. અ. વ.) ! હું પૂર્ણ કરું છું !

આ સાંભળીને ઉમર બીન ખત્તાબ (લ. અ.) ને ગુસ્સો આવ્યો અને તે પોતાના મિત્રને કહેવા લાગ્યા કે ફારસી (અ. ર.) આપણા કુરૈશના લોકો ઉપર ગર્વ કરવા ચાહે છે અને જૂઢુ બોલે છે. ઘણીવાર મેં જોયું છે કે રોજો રાખ્યો નથી હોતો, અને ઘણી રાત્રે એવું બને છે કે સૂતા હોય છે અને ઘણા દિવસો એવા પસાર થયા છે, જેમાં કુરઆન પઢતા જોયા નથી.

રસૂલેખુદા (સ. અ. વ.) એ તે સાંભળી ફરમાવ્યું :

સલમાને ફારસી (અ. ર.) નું દ્રષ્ટાંત હઝરતે લુકમાન (અ. સ.) જેવું છે, જેને શંકા હોય તે પોતે પૂછી લે, તેઓ જવાબ આપશે.

ઉમર બીન ખત્તાબે (તે વિષે) તરત જ પ્રશ્ન કર્યો.

જનાબે સલમાને ફારસી (અ. ર.) એ જવાબમાં ફરમાવ્યું :

✓ હું દર મહિને ત્રણ રોજા રાખું છું. અલ્લાહ તાદ્વાલા ફરમાવે છે કે દરેક નેકીનો દસ ગણો સવાબ મળે છે, તેથી મારા ત્રણ રોજા ત્રીસ રોજા સમાન છે. બલ્કે, હું તો તેથી પણ વધારે રોજા રાખું છું, કારણ કે શાઅબાનના આખા મહીનાના રોજા રાખું છું અને માહે રમઝાન સાથે જોડી દઉં છું.

- ✓ સૂતી વખતે વળું કરી લઉં છું અને હું રસૂલેખુદા (સ. અ. વ.) પાસેથી સાંભળી ચૂક્યો છું કે જે શાખ્સ વળું કરીને સૂઈ જશે, તેને એવો જ સવાબ મળશે, જાણો આખી રાત જાગીને ઈબાદત કરી હોય.
- ✓ હું દરરોજ ત્રણ વખત સૂરે અહદ (કુલ હો વલ્લાહનો સૂરો) પઢી લઉં છું, અને તે વિષે રસૂલેખુદા (સ. અ. વ.) પાસેથી સાંભળ્યું છે કે આપ (સ. અ. વ.) એ અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ (અ. સ.) ને ફરમાવ્યું :

ધો અલી (અ. સ.) ! તમારી મિસાલ મારી ઉમ્મતમાં એજ છે, જે સૂરે કુલ હો વલ્લાહો અહદની કુરઆનમાં છે. એટલે કે જે શાખ્સ સૂરે અહદ એક વખત પઢે છે, તેને ૧/૩ ભાગ કુરઆન પૂર્ણ કરવાનો સવાબ મળે છે અને જે બે વખત સૂરે અહદ પઢે છે, તેને ૨/૩ કુરઆન પૂર્ણ કરવાનો સવાબ મળે છે અને જે ત્રણ વખત સૂરે અહદ પઢે છે, તેને આખુ કુરઆન પૂર્ણ કરવાનો સવાબ મળે છે. એજ રીતે અય અલી (અ. સ.) ! જે તમને ઝબાનથી દોસ્ત રાખે છે, તેનું ૧/૩ ઈમાન પૂર્ણ છે. અને જે તમને ઝબાનથી અને દિલથી પણ દોસ્ત રાખે છે, તેનું ૨/૩ ઈમાન પૂર્ણ છે અને જે તમારો ઝબાનથી અને દિલથી દોસ્ત છે અને હાથ વડે તમારી મદદ પણ કરે છે, તેનું ઈમાન સંપૂર્ણ અને કામીલ છે....

૬. ઈમામ જઅફર સાદીક (અ. સ.) ફરમાવે છે :

રાત્રે સૂતી વખતે સૂરમો લગાવવાથી આંખોમાંથી પાણી નીકળતું બંધ થઈ જશે.

૭. ઈમામ જઅફર સાદીક (અ. સ.) ફરમાવે છે :

રસૂલેખુદા (સ. અ. વ.) એ ફરમાવ્યું :

અલ્લાહ તાલાનું ફરમાન છે :

જે પોતે જમીને સંતૃપ્ત થઈને સૂઈ જાય, પરંતુ તેની નજીક કોઈ મોઅમીન ભૂખ્યો હોય, તો તે મારી પર ઈમાન નથી લાવ્યો.

૮. હઝરત મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) ફરમાવે છે :

જે વળુની સાથે સુવે છે, જો તેને રાત્રે મૌત આવી જાય છે, તો પછી તે અલ્લાહની નજીદીક શહીદ છે.

૯. ઈમામ અલી ઈબ્ને અબી તાલીબ (અ. સ.) એ ઈમામ હસન (અ. સ.) ને ફરમાવ્યું :

શું તમે ચાહો છે કે હું તમને એવી ચાર ખાસિયતો જણાવું, જેની અદાયગી વડે તમને ડોકટરો / તબીબોનું કોઈ કામ ન પડે ? (તમે ડોકટરોથી બેનિયાઝ / મુક્ત થઈ જાવ ?)

ઈમામ હસન (અ. સ.) એ ફરમાવ્યું : જરૂર, અય અમીરુલ મોઅમેનીન (અ. સ.) !

ઈમામ અલી (અ. સ.) એ ફરમાવ્યું :

✓ જ્યાં સુધી વધારે પ્રમાણમાં ભૂખ ન લાગે, જમવું નહિં

✓ ભૂખ બાકી હોય, ત્યારે જ જમવાનું બંધ કરી દેવું

✓ ધીમે ધીમે ચાવવું

✓ સૂતા પહેલાં બયતુલ ખલા (કુદરતી હાજતે) જરૂર જઈ આવવું

૧૦. ઈમામ અલી રજા (અ. સ.) ફરમાવે છે :

જે શખ્સની આંખનો જોવાની શક્તિ કમજોર પડી ગઈ હોય, તેના માટે જરૂરી છે કે સૂતી વખતે ચાર ‘સલાઈંચા’ જમણી આંખમાં અને ત્રણ ‘સલાઈંચા’ ડાબી આંખમાં લગાવ્યા કરે.

- સલાઈઆ : સૂરમો લગાવવાની પાતળી સળી, જે એલ્યુભિનિયમ કે સીસા વગેરેની હોય છે. તે સૂરમાદાની / સૂરમાની બોટલ સાથે જ આવે છે.
- ચાર સલાઈઆ : ચાર વખત સળી વડે સૂરમો લગાવવો
- તીન સલાઈઆ : ત્રણ વખત સળી વડે સૂરમો લગાવવો

૧૪. નીચે મુજબના કાર્યો માટે વુઝુ મુસ્તહબ છે :

- નમાજે ભયત માટે
- કષ્ટસ્તાનમાં મોઅમ્ભીનોની કષ્ટોની જ્ઞાનારત માટે
- માર્શિયદમાં દાખલ થવા માટે
- ઈમામો (અ. મુ. સ.) ના હરમમાં દાખલ થવા માટે
- કુરઆને મજૂદ પાસે રાખવા માટે
- કુરઆને મજૂદની તિલાવત માટે
- કુરઆને મજૂદ લખવા માટે
- કુરઆને મજૂદના હાસિયાને અડવા માટે
- સૂતા પહેલા
- વગું કર્યું હોય તેના માટે ફરી વાર દરેક નમાજ માટે નવેસરથી વુઝુ કરવું

૧૫. જનાબતવાળા (જુનુબ) માટે નવ કાર્યો મકરૂહ છે :

- ખાવું અને પીવું, પણ અગર કોઈ હાથોને ઘોઈને તેમજ કોગળા કરીને ખાય કે પીવે તો મકરૂહ નથી. અને ફક્ત હાથોને ઘોઈને ખાય કે પીવે તો કરાહત ઓછી છે. (૧,૨)
- વાળું સજદાવાળી આપતો સિવાય સાત આપતોથી વધુ તિલાવત કરવી. (૩)
- કુરઆને મજૂદની જીછા, હાસિયા કે છપાઈ વર્ચ્યેની ખાલી જગ્યાને અડવી. (૪)
- કુરઆને મજૂદ પાસે રાખવું. (૫)
- ગુસ્લ કર્યા વિના સૂઈ રહેવું, પણ અગર વગું કરી લે અથવા પાણી ન હોવાને કારણે ગુસ્લને બદલે તયમુખ કરે, તો મકરૂહ નથી. (૬)
- મહેંદી વગેરેથી બાલ—દાઢી વગેરેને જિઝાબ કરવું, રંગવું. (૭)
- શરીર ઉપર તેલ ચોપડવું. (૮)
- ઉધની હાલતમાં મની (વીર્ય) બહાર આવે તેને ‘અહેતેલામ’ કહેવાય છે. ‘અહેતેલામ’ બાદ ગુસ્લ પહેલા સ્ત્રી—સંભોગ મકરૂહ છે. (૯)

૮. સૂતા પહેલાં પઢવાની દોઆ, જીક્ર અને તિલાવત

૧. ઈમામ અલી રજા (અ.સ.) ફરમાવે છે:
જે કોઈ સૂતા પહેલાં ‘આયતુલ ફુરસી’ની તિલાવત કરે, તો તે લક્વાથી સુરક્ષિત રહેશે અને જો તે દરેક નમાઝ પછી તેની તિલાવત કરે, તો કોઈ ઝેર (વિષ) તેને નુકસાન નહિં પહોંચાડે.
૨. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:
સૂતા પહેલાં સૂરે કાફેરુન અને સૂરે અહદ પઢો, કારણ કે સૂરે કાફેરુનનો વિષય શિર્કથી નફરત છે અને સૂરે અહદનો વિષય તૌહીદને જાહેર કરવું છે.
૩. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:
જે શખ્સ સૂતા પહેલાં સૂરે યાસીનની તિલાવત કરે, તો અલ્લાહ તાલાલા એક હજાર (૧૦૦૦) ફરીશતાને નિયુક્ત કરશે, જેઓ શૈતાનની બદ્દી અને દરેક પ્રકારની બલાથી તેનું રક્ષણ કરશે.
૪. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે:
જે શખ્સ દરરોજ રાત્રે સૂતા પહેલાં સૂરે વાકેઆની તિલાવત કરશે, ક્યામતના દિવસે તેનો ચહેરો ચૌદભી રાતના ચાંદની જેમ પ્રકાશિત હશે.
૫. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:
પથારી ઉપર સૂઈ જાવ, ત્યારે પઢો :
 - ✓ તરબીહે જનાબે ફાતેમા જહરા (સ. અ.)
 - ✓ આયતુલ ફુરસી
 - ✓ સૂરે ફલક અને સૂરે નાસ
 - ✓ સૂરે સાફફાતની શરૂઆતની દસ આયતો અને છેલ્લી દસ આયતો
૬. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:
જે શખ્સ સૂતા પહેલાં સો (૧૦૦) વખત ‘લા ઈલાહ ઈલ્હલ્લાહ’ પઢે, તો અલ્લાહ તાલાલા બેહિશ્તમાં તેના માટે એક મકાન બનાવશે અને જે શખ્સ સો (૧૦૦) વખત ‘ઈસ્તિગ્ફાર’ પઢે, તેના ગુનાહો એવી રીતે ખરી પડશે, જે રીતે વૃક્ષના પાંદડા ખરી પડે છે.
૭. હઝરત મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) ફરમાવે છે:
જે શખ્સ સૂતી વખતે સૂરે તકાસૂરની તિલાવત કરશે, તે કબ્રના અગાબથી સુરક્ષિત રહેશે.
૮. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:
જે શખ્સ સૂતી વખતે અગિયાર (૧૧) વખત સૂરે ઈન્ના અન્જલનાની તિલાવત કરશે, અલ્લાહ તાલાલા તેના માટે અગિયાર ફરિશતા નિયુક્ત કરશે, જેઓ સવાર સુધી તેને શૈતાનની બદીથી બચાવશે.
૯. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:
જે શખ્સ સૂતી વખતે સો (૧૦૦) વખત સૂરે કુલ હો વલ્લાહ પઢે, તેના પચાસ (૫૦) વર્ષના ગુનાહો માફ કરી દેવામાં આવશે.

નોંધ : રિવાયતમાં સૂતી વખતે પઢવાની દોઆ, જીક્ર અને તિલાવતનું વર્ણન ખૂબ જ વધારે જોવા મળે છે, તેથી આ પ્રકરણમાં નમૂનારૂપે અમુક જ બાબતો પ્રસ્તુત કરવામાં આવી છે :

૧૦. વહેલા ઉઠી શકતુ નથી, શું કરવું ?

૧. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

ખુદાનો જે કોઈ બંદો સૂતી વખતે સૂરે કહુફની છેલ્લી આયત (આયત નંબર ૧૧૦) ની તિલાવત કરશો, તો તે જે સમયે ઉઠવા ચાહશો, તેજ સમયે ઉઠી જશો.

૨. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે:

જે શખ્સ રાત્રીના કોઈ સમયે ઉઠી ઈબાદત કરવાનો ઈરાદો કરે અને જો તેનો આ ઈરાદો સાચો હોય, તો અલ્લાહ તખાલા બે ફરીશ્તાઓને મોકલે છે, જે તેના નક્કી કરેલા ચોક્કસ સમયે તેને (ઉઠવાનો) સંકેત આપી દે છે.

૩. ઈમામ મુસા કાજીમ (અ.સ.) ફરમાવે છે:

શરીરમાં વધારે પ્રમાણમાં ખુજલી આવવી, વધારે ઊંઘ આવવી, માથું દુઃખવું તેમજ અળાઈ (જ્ઞાણી ફોડકી) થવી લોહીના વધારે હોવાની નિશાનીઓ છે.



૧૧. ઉંઘ આવતી નથી !

૧. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે:

પાંચ પ્રકારના વ્યક્તિત્વોને ઉંઘ નથી આવતી:

૧. જે કોઈને કત્લ કરવાનો ઈરાદો ધરાવતો હોય

૨. જેની પાસે વધારે માલ હોય પણ તેને કોઈની ઉપર વિશ્વાસ ન હોય અને તે માલ લૂંટાઈ જશે તેવો ડર હોય

૩. જેણે લોકોને ઘણી બધી ખોટી વાતો કહી હોય તેમજ લોકો ઉપર ઘણા આક્ષેપો કર્યા હોય

૪. જેની પાસે ભાંગણી – ઉધરાણી – પ્રશ્નો કરનારા ઘણા બધા હોય અને તેની પાસે ચૂકવણી – જવાબ માટે પૂરતા પ્રમાણમાં (વ્યવસ્થા) ન હોય

૫. જે કોઈના પ્રેમમાં હોય અને તેના છીનવાઈ જવાનો ડર હોય

૨. ઈમામ અલી ઈજ્ઝે અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

જે શખ્સ ઉંઘમાં ડરતો હોય અથવા ઉંઘ ન આવવાના કારણે પરેશાન હોય, તો આ (નીચે આપેલી) આયત પઢવી

બિસ્મીલ્હા હિર રહમા નિર રહીમ

ફરજબના અલા આજાનેહીમ ફીલ કહફે સેનીન અદદન સુખ્મ બઅસના હુમ લે નઅલમ અય્યુલ હિજબયને અહસા લેમા લબેસૂ અમદા

જો બાળક વધારે રડતું હોય, તો તેની ઉપર પણ આજ આયત પઢવી.

૩. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

જેને ઉંઘ ન આવતી હોય, તેણે આ દોઆ પઢવી :

સુખ્માનલ્હાહે ગીશશઅને દાએમીસુલ્તાને કુલ્લ યવમીન હોવ ફી શઅનીન

૪. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

નિયુક્ત ફરિશ્તો નીદા આપે છે કે જે અડધી રાત સુધી નમાઝે ઈશા પઢ્યા વગર સૂર્ય જાય, તો અલ્લાહ તેની આંખોને ઉંઘ નસીબ નહિં કરે.

૫. ઈમામ અલી ઈજ્ઝે અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

ઇન્સાન દીકરાની મૌત ઉપર સૂર્ય શકે છે પરંતુ તે જુલ્મ ઉપર નથી સૂર્ય શકતો.

૬. ઈમામ અલી રજા (અ.સ.) ફરમાવે છે :

આઠ ચીજો અસ્તિત્વમાં આવતી નથી, સિવાય કે અલ્લાહની કગા અને કદ્ર :

- ઉધ
- બેદારી (જાગૃતાવસ્થા)
- તાક્ત
- કમજોરી
- તંદુરસ્તી
- બિમારી
- મૌત
- હૃદાત (જુંદગી)

✓ કરા અને કદ્ર : અલ્લાહનો હુકમ અને તેનું નિર્માણ, અલ્લાહની ઈચ્છા અને તેનો નિર્ણય

૧૨. વહેલી સવારે...

૧. અલ્લાહના રસૂલ (સ. અ. વ.) ફરમાવે છે :

સૌથી શ્રેષ્ઠ જેહાદ એ છે કે જ્યારે કોઈ શબ્દ સૂઈને ઉઠે, તો તેના હિલમાં કોઈ ઉપર ઝુલ્ભ કરવાનો ઈરાદો ન હોય.

૨. ઈમામ મુસા કાજીમ (અ. સ.) એ એક વેપારીને ફરમાવ્યું :

તું વહેલી સવારે એ ચીજની તરફ જા કે જે તારા માટે ઈજાતનું કારણ છે, એટલે કે બજારમાં.

૩. ‘દોઆએ સબાહ’, નમાઝ સુખ પછી પઢવાની ઈમામ અલી ઈજ્ઞે અભી તાલીબ (અ. સ.) ની પ્રખ્યાત દોઆ છે. ‘સબાહ’ શબ્દ સુખ (સવાર)ની સાથે સંબંધ ધરાવે છે. નમાઝ સુખની તઅકીબાતમાંથી એક એવી અસરકારક અને મહત્વપૂર્ણ દોઆ, જેમાં બંદો વહેલી સવારે પોતાના રબ પાસે દીન અને દુનિયાની માંગણીઓ કરે છે. દોઆએ સબાહના કેટલાક વાક્યો આ મુજબ છે :

અય અલ્લાહ ! અમારા માટે રહેમત અને સફળતાની ચાવીઓ વડે સુખના દરવાજાને ખોલી નાખ.....

બસ અય અલ્લાહ ! મારી આ (આજની) સવારને હિદાયતની રોશની તેમજ દીન અને દુનિયાની સલામતી બનાવીને મારી તરફ નાઝીલ કર.

અને આ (આજની આવનારી) રાતને દુશ્મનોના પ્રપંચ સામે ઢાલ અને હલાક કરી દેનારી ઈચ્છાઓ સામે રક્ષક બનાવી દે.....

અને તે તારા લુત્ફ વડે સુખને જાહેર કરી અને તેજ તારા કરમ વડે અંધારી રાત્રિઓને રોશન બનાવી અને તેજ સખત પત્થરોમાંથી મીઠા અને ખારા પાણીના જરણા વહેતા કર્યા, અને તે આકાશમાંથી વરસતુ મીહું પાણી નાઝીલ કર્યું, અને તે સૂર્ય અને ચંદ્રને ઈન્સાનો માટે પ્રકાશિત દિપક બનાવ્યા..

૪. ઈમામ જેનુલ આબેદીન (અ. સ.) ને પૂછુવામાં આવ્યું :

આપ (અ. સ.) એ કેવી હાલતમાં ‘સુખ’ (સવાર) કરી ?

આપ (અ. સ.) એ ફરમાવ્યું :

મેં એવી હાલતમાં ‘સુખ’ (સવાર) કરી કે આઠ પ્રકારની ચીજો મારી પાસે માંગણી કરી રહી હતી :

1. અલ્લાહ તઆલા : ફરજોની (અદાયગીની)
2. નબી (સ. અ. વ.) : સુન્નતની (અદાયગીની)
3. પરિવારના સત્યો : ખોરાક અને ખર્ચની
4. નફ્સ : ખાહીશાત(ઈચ્છા)ની પૂર્તિની
5. શૈતાન : અલ્લાહની નાફરમાનીની
6. બે ફરીશ્તા : સાચા અમલની
7. મલેકુલ મૌત : રૂહની
8. કષ્ટ : શરીરની.....

૫. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :
 તૌરાતમાં છે કે જે શખ્સ દુનિયા બાબતને ગમગીન થઈને ‘સુભુ’ કરશે, તે પોતાના રબ ઉપર નારાજગીની સાથે ‘સુભુ’ કરશે.
૬. ઈમામ અલી રહા (અ.સ.) ફરમાવે છે :
 જે શખ્સ એવી હાલતમાં ‘સુભુ’ કરે, કે તેને મુસલમાનોના કાર્યોની કોઈ પરવા (ચિંતા) ન હોય, તે મુસલમાન નથી.
૭. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :
 મોઅમ્મીન માટે યોગ્ય નથી કે સવારના સમયે કંઈ ખાધા વિના ઘરની બહાર નીકળે, કારણ કે સવારના સમયે ખાઈને નીકળવું ઈજાતમાં વધારો થવાનું કારણ છે.
૮. અલ્લાહના રસૂલ મોહમ્મદ (સ.અ.વ.) ફરમાવે છે :
 જ્યારે આદમ (અ.સ.) ના ફરજાંદ સવારે જાગે છે, ત્યારે તેમના શરીરના અંગો પણ જાગી જાય છે અને તેઓ બધા ‘ગુબાન (જીબ)’ ની સમક્ષ હાજર થઈને કહે છે :
 અમારા માટે અલ્લાહનો ખૌફ રાખજે, કારણ કે જો તુ સીધી અને મક્કમ રહીશ, તો અમે પણ સીધા (સલામત) રહીશું અને જો તુ આડી થઈશ, તો અમે પણ સખ્તીમાં સપડાઈ જઈશું.
૯. અલ્લાહના રસૂલ (સ.અ.વ.) ફરમાવે છે :
 જે શખ્સ સુભુસાદીક (પરોઢિયા)થી સૂર્ય ઉગે ત્યાં સુધી પોતાની નમાજની જગ્યાએ બેસી રહે, અલ્લાહ તેને જહન્નમની આગથી બચાવી લેશે.
૧૦. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :
 ...સહરી (સુભુ)ના સમયે વજુ પહેલાં મિસ્વાક (બ્રશ કરવું) સુન્નત છે.
૧૧. રાવિ કહે છે કે મેં ઈમામ જઅફર સાદીક (અ.સ.) ને પૂછ્યું :
 સુભુની નમાજનો શ્રેષ્ઠ સમય કયો છે ?
 ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું :
 “ તુલુએ ફજૂ ” (ફજૂનો પ્રારંભ, સુભુ સાદીકનો સમય.)
- અલ્લાહ તથાલા ફરમાવે છે :
 ઈન્ન કુરઆનલ ફજરે કાન મશહૂદા
- સવાર અને સાંજના ફરિશ્તા નમાજે ફજૂ (સુભુની નમાજ)ને નિહાળે છે.
 જે શખ્સ “ તુલુએ ફજૂ ” ના સમયે નમાજ પદ્ધશે, તો તે નમાજ બે વખત લખવામાં આવશે, એક વખત રાતના ફરિશ્તા અને એક વખત દિવસના ફરિશ્તા (તેને) લખશે.
૧૨. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) રસૂલેખુદા (સ.અ.વ.)થી રિવાયત કરતા ફરમાવે છે :
 અલ્લાહ સુભુનહુ વ તથાલાએ ફરમાવ્યું :
 અય આદમ (અ.સ.)ની ઔલાદ ! સુભુ અને અસ્રની નમાજ પદ્ધી એક-એક કલ્લાક મારો ઝીક્ર કર, જેથી હું તારી મહત્વપૂર્ણ માંગણીઓની પૂર્તિ કરું.
૧૩. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

અલ્લાહ તઆલા મોઅમીનોની દરેક દોઆને પસંદ કરે છે. હું તમને સહરીથી તુલુએ શમ્સ (સુષ્ણ સાદીકથી સૂર્ય ઉગવાના સમય) સુધી દોઆ (કરવાની) નસીહત કરું છું કારણ કે આ સમય દરમિયાન આસમાનના દરવાજા ખોલી નાખવામાં આવે છે, રહેમતની હવા ચાલે છે, રોજી વહેંચવામાં આવે છે અને મોટી-મોટી માંગણીઓ પૂરી થાય છે.

૧૪. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

રોજી મુકર્રર, નિશ્ચિયત અને વહેંચાયેલી છે, અને અલ્લાહ તરફથી ‘ફજ્લ’ પણ છે (જેની વહેંચણી કરવામાં નથી આવી), તે (ફજ્લ)ને તે (અલ્લાહ) ફજ્ર (સુષ્ણસાદીક)ની શરૂઆતથી સૂર્ય ઉગે તે સમય દરમિયાન વહેંચે છે.

અલ્લાહ સુષ્ણાનહું વ તઆલા ફરમાવે છે :

... વ અસ્સલુલ્લાહ મીન ફજ્લેહી (સૂરે નિસા : ૩૨)

(ઉપરોક્ત) આયત આજ બાબત સંબંધિત છે.

પછી ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું :

ફજ્ર (સુષ્ણ સાદીક)ની શરૂઆતથી અલ્લાહનો ઝીક્ર કરવો ધરતીના પટ ઉપર રોજી મેળવવા કરતા વધારે બહેતર છે.

૧૫. લોકોએ ઈમામ જઅફર સાદીક (અ.સ.)ને પૂછ્યું :

અમે સાંભળ્યું છે કે સુષ્ણની નમાજ પછીથી સૂર્ય ઉગે ત્યાં સુધી ‘તઅકીબાત’ પઢવી એ રોજી વધારવા માટે એક શહેરથી બીજા શહેર ફરવા કરતા બહેતર છે !?!?

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું :

શું તમે ઈચ્છો છો કે હું તમને એવી ચીજ જણાવું, જે તેનાથી પણ વધારે ફાયદો પહોંચાડે ??!

તેઓએ કહુંઃ હા, અય રસૂલેખુદા (સ. અ. વ.)ના ફરજંદ!

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું :

દર શુક્રવારે નખ કાપવા / કપાવવા તેમજ મૂછો કતરવી / કપાવવી અને જો નખ બહુ મોટા ન હોય, તો થોડા ઘસી લેવા.

૧૬. રસૂલેખુદા હજરત મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) ફરમાવે છે:

દોઆ માંગવાનો શ્રેષ્ઠ સમય ‘સેહર’ નો (સમય) છે.

✓ સેહર : સૂર્ય ઉગે તે પહેલાંનો સુષ્ણનો સમય

૧૭. રસૂલેખુદા હજરત મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) ફરમાવે છે:

કાગડા પાસેથી ત્રણ બાબતો શીખો :

1. છુપાઈને સંભોગ કરવો
2. વહેલી સવારે રોજીની તલાશમાં નીકળવું

૩. દુશ્મનોથી અત્યંત સાવચેત રહેવું

૧૮. ઈમામ જાફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

સવારનો પ્રારંભ સદકા વડે કરો, તેનાથી દિવસની નહૂસત દૂર થાય છે. તેજ રીતે રાતનો પ્રારંભ પણ સદકા વડે કરો, તેનાથી રાતની નહૂસત દૂર થાય છે.

૧૯. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

જે શખ્સના હાથમાં અકીકની વીટી હોય અને તે વહેલી સવારે જાગીને તરત જ કોઈ તરફ નજર કરે તે પહેલા વીટીનો નગીનો પોતાની હથેળીની તરફ ફેરવીને તેની તરફ નજર કરે અને સૂરે ઈન્ના અન્ગલાણ તેમજ નીચે આપેલી દોઆ પઢે, તો પરવરદીગારે આલમ તેને તમામ બલાઓથી સુરક્ષિત રાખશે, પછી તે આકાશમાંથી ઉત્તરવાની હોય કે જમીનમાંથી ઉપર આવવાની હોય કે જમીનમાં સમાઈ જવાની હોય કે જમીનમાંથી બહાર નીકળવાની હોય, અને તે શખ્સ સાંજ સુધી ખુદા અને ખુદાના દોસ્તોના રક્ષણ અને મદદમાં રહેશે :

“આમન્તો બિલ્લાહે વહદહુ લા શરીક લહુ વ કફરતો બીલ જીબ્તે વ તાગુતે વ આમન્તો બેસીરેં આદે મોહમ્મદીન વ અલાનેયતેહીમ વ જાહેરેહીમ વ બાતેનેહીમ વ અવ્યલેહીમ વ આખેરેહીમ”

૧૩. ઊંઘ અને મૌત

૧. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે:

લુકમાન(અ.સ)એ પોતાના પુત્રને નસીહત કરતા ફરમાવ્યું:

દીકરા ! જો તને મૃત્યુ બાબત કોઈ શંકા હોય, તો ઊંઘને તારાથી અલગ કરી લે. તું તેમ કરી શકતો નથી. જો તને મૃત્યુ પછી જીવંત થવા બાબતે શક હોય, તો ઊંઘ પછી જાગી જવાના પ્રસંગને તારાથી અલગ કરી લે. તું કયારેય તે કરી શકીશ નહિં. જ્યારે તું આ બન્ને હાલતો ઉપર વિચાર કરીશ, તો સમજાઈ જશે કે તારો જીવ બીજાના કાખુમાં છે, ઊંઘની હાલત મૃત્યુ છે અને તેમાંથી જાગવું મૃત્યુ પછી ઉઠવા સમાન છે.

૨. અબુ બસીરે ઈમામ જઅફર સાદીક (અ.સ.)ને પૂછ્યું :

એક પૂરુષ કે સ્ત્રી અહી સૂતા હોય છે, અને તે (સ્વખભમા) જુએ છે કે તે (પોતે) મક્કા અથવા બીજા કોઈ શહેરમાં છે. તો શું તેમની રૂહ તેમના શરીરમાંથી નિકળી ચૂકી હોય છે?!

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું :

અબુ બસીર ! એ વાત નથી ! કારણ કે જ્યારે રૂહ શરીરમાંથી નિકળી જાય છે, તો પછી પલટીને પરત આવતી નથી. તેનો દાખલો એ સૂર્ય જેવો છે, જે આકાશની મધ્યમાં હોય છે પણ તેના કિરણો દુનિયાભરમાં ફેલાયેલા હોય છે.

૩. ઈમામ મુસા કાજીમ (અ.સ.)એ ફરમાવ્યું :

જ્યારે ઈન્સાન સૂર્ય જાય છે, તો તેના શરીરમાં ‘રૂહે હૃદયવાની’ બાકી રહે છે અને ‘રૂહે અકલ’ બહાર નીકળી જાય છે.

૪. ઈમામ અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

ઊંઘ તકલીફમાંથી રાહત અને મૌતની હમશકલ છે.

૫. ઈમામ અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

બેશક શરીર છ હાલતોમાંથી પસાર થાય છે :

1. તંદુરસ્તી

2. બિમારી

3. મૌત

4. જુંદગી

5. ઊંઘ

6. જાગૃતિ (જાગવું)

રૂહ બાબતે પણ આવું જ છે :

✓ ઈલ્મ તેની જુંદગી છે

✓ જહાલત તેની મૌત છે

✓ શંકા તેની બિમારી છે

- ✓ યકીન તેની તંદુરસ્તી છે
- ✓ બેદરકારી તેની ઊંઘ છે
- ✓ સલામતી તેની જાગૃતાવસ્થા છે.

૬. અલ્લાહ તખાલા પોતાની કિતાબ કુરાનમાં ફરમાવે છે:

અને તે (અલ્લાહ) એજ છે જે રાત્રે (ઉંઘમાં) રૂહ લઈ લે છે અને દિવસે જે કાર્યો તમે કરી ચૂક્યા છો તેને પણ જાણો છે. પછી તે તમને તે (ઉંઘ)માંથી ઉઠાડી ઉભા કરે છે કે (જેથી જુંદગીનો) નક્કી કરેલો સમય પૂરો થવા પામે. પછી તેની જ સમક્ષ પાછા ફરવાનું છે. પછી જે કાંઈ તમે કર્યો કરતાં હતાં તેનાથી તે તમને વાકેફ કરી દેશે.

૭. ઈમામ અલી ઈજને અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

અલ્લાહ તખારક વ તખાલાએ રૂહને પેદા કરી અને તેના માટે ઓક હાકીમ (બાદશાહ) નિયુક્ત કર્યો. તે બાદશાહ નફ્સ છે. જ્યારે ઈન્સાન સૂઈ જાય છે, ત્યારે રૂહ બહાર નીકળી જાય છે અને તેનો બાદશાહ (નફ્સ) ત્યાં જ હાજર રહે છે. તેની પાસેથી ફરિશતા અથવા જીનાતોના સમૂહ પસાર થાય છે. બસ, સાચા સ્વખન ફરિશતા તરફથી હોય છે અને જૂઠા સ્વખન જીનાત તરફથી હોય છે.

૮. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

જ્યારે બંદો સૂઈ જાય છે, ત્યારે તેમની રૂહો આસમાન તરફ નીકળી પડે છે. રૂહો આસમાનમાં જે કાંઈ જુએ છે, તે સત્ય હોય છે અને જે કાંઈ હવામાં જુએ છે, તે ઉડતા અને પરેશાન કરનારા સ્વખન હોય છે.

૯. ઈમામ અલી ઈજને અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

લોકો ઉધમાં છે, જ્યારે મૌત આવશે, ત્યારે જાગશે.

૧. એક શખ્સે ઈમામ જઅફર સાદીક (અ.સ.)ની બિદમતમાં આવીને ફરીયાદ કરી કે એક સ્ત્રી તેને સ્વખનમાં આવીને ડરાવે છે.
ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: એવું બને કે તું ઝકાતની ચૂકવણી ન કરતો હોય !
 તેણે કહ્યું: અય રસૂલેખુદા (સ. અ. વ.) ના ફરજંદ ! હું તો નિયમિતપણે ઝકાતની ચૂકવણી કરું છું.
ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું:
 તે (ઝકાત) યોગ્ય બ્યક્તિ સુધી પહોંચતી નહિં હોય !
 ત્યાર પછી તે શખ્સે ઝકાતની રકમ યોગ્ય બ્યક્તિ સુધી પહોંચાડી આપવા ઈમામ (અ.સ.)ને આપી દીધી અને આ સાથે જ તેની ડરી જવાની તકલીફ પણ દૂર થઈ ગઈ.
૨. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે:
 જે શખ્સ ઊંઘમાં ડરી જતો હોય, તેણે સૂવાના સમયે મઉઝતબન (સૂરે ફલક અને સૂરે નાસ) તથા આયતુલ કુરસી પઢી લેવી.
૩. એક શખ્સે ઈમામ જઅફર સાદીક (અ.સ.)ને ફરિયાદ કરી કે તેની દીકરી ઊંઘમાં ડરી જાય છે. કયારેક તો એવું થાય છે કે તેના શરીરના અંગો શિથિલ અને ઢીલા બની જાય છે. લોકોનું કહેવું છે કે આવું જીનના હાવી થઈ જવાથી થાય છે.
ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: તેને ‘ફસ્ટ’ કરાવી લો તેમજ સૂવાની ભાજી (કે જે સુગંધિત હોય છે) તેના રસને મધમાં પકાવો અને ત્રણ દિવસ સુધી પીવરાવો.
ઈમામ (અ.સ.)ના આ હુકમ પર અમલ કરવાથી તેની દીકરીએ બિમારીમાંથી રાહત મેળવી.
 (‘ફસ્ટ’ એટલે તથીબી હેતુ માટે ખરાબ અને અશુદ્ધ લોહીને રકતવાહીની / લોહીની નસમાંથી વહેવડાવી દેવું)
૪. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :
 જો તમને ઊંઘમાં વિર્યસ્ખલન (એહેતેલામ) થઈ જવાનો ડર હોય, તો સૂતી વખતે આ મુજબ કહેવું :
 અલ્લાહુમ્મ ઈન્ની અઉઝોબેક મેનલ એહેતેલામ વ મિન સૂઈલ અહ્લામ વ મિન અન યતલાએબ બી શશ્યતાન ફી યક્ઝલતે વલ મોનામે
 અય અલ્લાહ ! બેશક હું તારી પનાહ (રક્ષણ) ચાહું છું વિર્યસ્ખલનથી, ખરાબ સ્વખનથી અને તે કાર્યથી જેમાં ઊંઘ દરમિયાન અને જાગતી વખતે શૈતાન મારી સાથે કોઈ અટકચાળા (રમત) કરે.
૫. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :
 જે શખ્સને મકાન અથવા ઉજજડ સ્થળે એકલા સૂંઠું પડે, તો તેણે આ દોઆ પઢવી જોઈએ :
 અલ્લાહુમ્મ આનિસ વહશતી વ અશેની અલા વહદતી
૬. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :
 જ્યારે બંદો અલ્લાહની નાફરમાની માટે તૈયાર થાય છે અને ખુદા તેની ભલાઈ ચાહતો હોય છે, ત્યારે તેને ઊંઘમાં એવી ચીજો દેખાડે છે, જે તેને ઢંઢોળી નાખે છે (હચમચાવી નાખે છે), જેના કારણે તે શખ્સ તે નાફરમાનીથી બચી જાય છે.

**૧૫. રાત્રે ઉજાગરા કરવા,
નકામા કાર્યો માટે જાગવું**

૧. હિન્દુ ઈસા(અ.સ.) ફરમાવે છે :

અલ્લાહ સુભાનહુ વ તથાલાએ રાતને ત્રણ કાર્યો / હેતુઓ માટે અને દિવસને સાત હેતુઓ / કાર્યો માટે બનાવ્યા છે. જે કોઈ પણ રાત અને દિવસને તેના નકકી કરેલા કાર્યો વિના પસાર કરે છે તેના માટે આ રાત અને દિવસ કયામતના દિવસે તેની વિરુદ્ધ હશે.

અલ્લાહ તથાલાએ રાતને ત્રણ હેતુઓ માટે બનાવી છે :

1. મહેનત અને પરિશ્રમના કારણે થાકી ગયેલા શરીરના અંગોના આરામ માટે
2. દિવસે કરેલા ગુનાહોની માફી માગવા અને ફરીથી તે ગુનાહો તરફ પાછા ન ફરવા માટે
3. સહનશરીલ / ધૈર્યવાનની જેમ આજ્ઞાકિત બનીને (અલ્લાહ સમક્ષ) ઉભા રહેવા

આમ, રાતના એક ભાગમાં સૂવું, બીજા ભાગમાં (ઇસ્લિઝફાર માટે) ઉભા થવું અને ત્રીજા ભાગમાં વિનપ્રતાની સાથે અલ્લાહની સમક્ષ હાજર રહેવું જોઈએ. બસ આજ કાર્યો માટે રાતને પેદા કરવામાં આવી છે.

૨. અલ્લાહના રસૂલ (સ. અ. વ.) ફરમાવે છે:

ત્રણ કામો સિવાય અન્ય કોઈ કામ માટે જાગતા રહેવું / જાગવું યોગ્ય નથી:

1. નમાઝ શબની અદાયગી માટે
2. કુરાઓની તિલાવત અને ઈલમપ્રાપ્તિ માટે
3. તે હુલ્હન માટે જેને તેના પતિના ઘરે મોકલવામાં આવી રહી હોય (લગ્નની પ્રથમ રાત્રિએ)

૩. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

જે શાખ્સ માલ કમાવવાના હેતુથી આખી રાત જાગતો રહે અને પૂરતી ઊંઘ ન લે, તો તે કમાણી તેના માટે હરામ છે.

૪. અલ્લાહના રસૂલ (સ. અ. વ.) ફરમાવે છે:

ઈશાની નમાઝ પછી (વ્યર્�) વાતો કરવી અને નકામી સભાઓ—બેઠકો—મીટિંગો યોજવી અણગમતું અને ઘૃણાજનક (મકરૂહ) કાર્ય છે.

[ઈશાની નમાઝ પછી મજલીસે હુસૈન અ.સ., ઈલમપ્રાપ્તિ અને અજાદારી જેવા ઈબાદતના કામોમાં વ્યસ્ત રહેવું અલ્લાહની ખુશુદીનું કારણ બને છે. ઈશાની નમાઝ પછી પોતાની મંડળી, ટોળકી, ચુપ અને મિત્રવર્તુળની સાથે નકામી બેઠકો યોજવી, વ્યર્થ ચર્ચામાં પ્રવૃત્ત રહેવું, વિવાદાસ્પદ મુદ્દાઓનું પૃથ્વીકરણ અને પોસ્ટમોર્ટમ કરવું, ટીવી જોવું, કેરમ – વીડીયોગેમ, રાત્રિ ટુનામેન્ટ, રાત્રે રમાતી શેરી ડ્રિકેટ વગેરે વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો ઈન્સાનને અલ્લાહથી વિમુખ બનાવી દે છે અને ગુનાહો તરફ ખેંચી જાય છે. આ પ્રકારના નિરર્થક કામો અંજામ આપવામાં કોઈપણ પ્રકારની ભલાઈ રહેલી નથી. આવા કાર્યોમાં પ્રવૃત્ત રહેવાને બદલે વજુ કરી અલ્લાહના જીક્રની સાથે સૂઈ જવું દુનિયા અને આખેરતની ભલાઈ માટે વધારે

સલાહભર્યું અને હિતાવહ છે. ઈમામે જમાના (અ.સ.)ની ગૈબતના વર્તમાન સમયમાં મોડી રાત સુધી નકામી ચર્ચામાં વ્યસ્ત રહી સુષ્ણની નમાજ સમયસર અદા ન કરવી સામાન્ય વાત બની ગઈ છે. જગતના ખૂણેખૂણામાં ગુનાહો સર્વત્ર અને વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયા હોવાથી દુનિયા અને આખેરતની સુધારણા માટે ઈશાની નમાજ પછી અલ્લાહના જીક્રની સાથે સૂઈ જવામાં જ ઈન્સાનની ભલાઈ રહેલી છે]

૫. અલ્લાહના રસૂલ હજરત મોહમ્મદ (સ. અ. વ.) ફરમાવે છે:

અદ્ધી રાત પછી માત્ર બે (પ્રકારના) વ્યક્તિત્વે જાગવું જોઈએ: (૧) નમાજી (૨) મુસાફર (પ્રવાસી)

૧. ઈમામ અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે:

નશો ચાર પ્રકારનો છે:

૧. શરાબનો નશો

૨. માલ—સંપત્તિનો નશો

૩. ઊંઘનો નશો

૪. સત્તા / હોકાનો નશો

૨. ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે:

શૈતાન પાસે એક સૂરમો (આંખમાં લગાડવાની ચીજ) છે જેને તે લોકોની આંખોમાં લગાડી દે છે, તેની પાસે એક ચાટવાની ચીજ છે જેને તે (લોકોને) ચટાડી દે છે અને એક સૂંઘવાની ચીજ છે જેને તે (લોકોને) સૂંઘાડી દે છે.

✓ તે સૂરમો ઊંઘ છે,

✓ ચાટવાની ચીજ જૂઠ છે

✓ સૂંઘવાની ચીજ અભિમાન, ગર્વ અને ધમંડ છે.

૧૭. કેલુલહ (બપોરની જરામાત્ર ઉંઘ)

૧. એક શખ્સે અલ્લાહના રસૂલ હજરત મોહમ્મદ મુસ્તફા (સ. અ. વ.) ની ખિદમતમાં આવીને કહું:
પહેલાં મારી યાદશક્તિ ખૂબ જ સારી હતી પરંતુ હવે હું બહુ ભૂલી જવા લાગ્યો છું.
આપ (સ. અ. વ.) એ ફરમાવ્યું:
તું પહેલાં કેલુલહ (બપોરનો જરાક એવો આરામ) કરતો હતો તે હવે નથી કરતો ?!?!
તેણે કહું: હા !! અથ અલ્લાહના રસૂલ (સ. અ. વ.) !
આપ (સ. અ. વ.) એ ફરમાવ્યું: ફરીથી કેલુલહ શરૂ કરી દે!
તેણે સલાહ મુજબ અનુસરણ કર્યું અને ફરીથી યાદશક્તિ પાછી આવી ગઈ.
૨. રિવાયતમાં છે કે ‘કેલુલહ કરો, કારણ કે શૈતાન કેલુલહ નથી કરતો, અને કેલુલહ રાત્રે જાગી ઈબાદત કરવામાં ખૂબ મદદરૂપ બને છે.’

૧૮. ઉંઘના પ્રકાર

૧. ઈખામ અલી ઈબ્ને અબી તાલીબ (અ. સ.) ફરમાવે છે:
સૂવાના ચાર પ્રકાર છે:
૧. પયગઘર જ્યારે સૂવે છે, તો તેમની આંખો બંધ થતી નથી. તેઓ અલ્લાહ તરફથી આવતી વહીની રાહ જોતા હોય છે.
 ૨. મોઅમ્મિનો જ્યારે સૂવે છે, તો કીલ્લાની તરફ જમણા પડ્યે સૂવે છે.
 ૩. દુનિયાના સત્તાધીશો, રાજાઓ અને રાજકુમારો ડાબા પડ્યે સૂવે છે જેથી કરીને જે કાંઈ તેઓ ખાઈ ચૂક્યા છે તે હજમ થઈ સમતળ બની જાય.
 ૪. શૈતાન, શૈતાનના ભાઈઓ અને પાગલ લોકો ઉંઘા સૂવે છે.

૧૮. કયારેક ઊંઘ ઈબાદત કરતા બહેતર હોય છે!

૧. ઈમામ અલી ઈજ્ઞે અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

યક્ષીન અને મઅરેફતની સાથે સૂઈ જવું એ શકની હાલતમાં નમાજ પઠવા કરતા બહેતર છે.

૨. ઈમામ અલી ઈજ્ઞે અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

કેટલાય એવા રોજા રાખનારા છે જેમને ભૂખ અને તરસ સિવાય કાંઈ જ નથી મળતું અને કેટલાય એવા રાતે ઈબાદત કરનારા છે જેમને તેના બદલામાં માત્ર જાગરણ / રતિજગા અને થાક જ મળે છે. હોશિયાર મઅરેફત ધરાવનારાઓની ઊંઘ અને તેઓના ઈફતાર (જમવું) કેટલા સારા છે !!

૩. ઈમામ અલી ઈજ્ઞે અભી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

ધણા ભાગદોડ કરવાવાળા બેઠા હોય છે, ધણા જાગવાવાળા સૂતા હોય છે.

૪. અલ્લાહ તઆલા પોતાની કિતાબ કુરાઅનમાં ફરમાવે છે :

અને લોકોમાંથી (કોઈ) એવા (પણ) છે, જે અલ્લાહની ખુશી સંપાદન કરવા (માટે) પોતાનો જીવ (નફસ) પણ વેચી નાખે છે, અને અલ્લાહ બંદાઓ પ્રત્યે માયાળું છે.

[હિજરતની રાત હજરત અલી (અ.સ.) એ પયગમ્બર (સ.અ.વ.) ના બિસ્તર ઉપર સૂઈને પસાર કરી. ઈતિહાસમાં તે રાત ‘લયલતુલ મુખીત’ તરીકે પ્રખ્યાત છે. આ (ઉપરોક્ત) આયત અલી અ.સ. ની શાનમાં નાગીલ થઈ છે. આપ (અ.સ.) તે સમયે રસૂલેખુદા (સ.અ.વ.) ના બિસ્તર ઉપર સૂઈ રહ્યા હતા]

૫. હજરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) ફરમાવે છે :

પરીક્ષિત વ્યક્તિ જે ઊંઘમાં (સુતી) હોય છે, તે અલ્લાહની નજીદીક એવા રોકેદાર – નમાજી કરતા બહેતર છે, જે

અપરીક્ષિત હોય છે.

૨૦. રોજેદારની ઊંઘ

૧. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

રસૂલેખુદા (સ. અ. વ.) એ ફરમાવ્યું :

રોજેદાર અલ્લાહની ઈબાદતમાં હોય છે, ભલે ને પછી તે પથારી ઉપર સૂતો કેમ ન રહે ! અલબત, તે ત્યાં સુધી જ ઈબાદતમાં રહે છે, જ્યાં સુધી કોઈ મુસલમાનની ગીબત ન કરી લે.

૨. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

રસૂલેખુદા (સ. અ. વ.) એ ફરમાવ્યું :

રોજેદારની ઊંઘ ઈબાદત અને (તેનો) શ્વાસ તરબીહ છે.

૩. ઈમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

રોજેદારની ઊંઘ ઈબાદત, ખામોશી તરબીહ, અમલ કબૂલ અને દોઆ સ્વીકાર્ય છે.

૨૧. કુરાનમાં ‘ઉંઘ’ નો ઉલ્લેખ

૧. અહ્વાહ તથાલા પોતાની કિતાબ કુરાનમાં ફરમાવે છે :

અને તમારું રાત્રે અને દિવસે ઉંઘવું તથા તેના ફ્ઝલ (કૃપા) વડે રોજીનું ચાહવું, એ પણ તેની નિશાનીઓમાંથી છે. બેશક સાંભળનારાઓ માટે એમાં ચોક્કસપણે નિશાનીઓ રહેલી છે.

૨. અહ્વાહ તથાલા પોતાની કિતાબ કુરાનમાં ફરમાવે છે :

શું તેઓ નથી જોતા કે અમે રાતને એટલા માટે બનાવી છે કે તે દરમિયાન તેઓ આરામ કરે અને દિવસને પ્રકાશિત બનાવ્યો ? ખરેખર એમાં પણ ઈમાનવાળા માટે નિશાનીઓ રહેલી છે.

૩. અહ્વાહ તથાલા પોતાની કિતાબ કુરાનમાં ફરમાવે છે :

અને તે એજ છે જેણે રાતને તમારા માટે લિબાસ બનાવી છે અને ઉંઘને (તમારા માટે) રાહત અને દિવસને ફરીથી ઉઠવા—બેસવા માટે બનાવ્યો છે.

૪. અહ્વાહ તથાલા પોતાની કિતાબ કુરાનમાં ફરમાવે છે :

અને શું તમારી ઉંઘને થાક દુર કરનારી નથી બનાવી ??

અને અમે રાતને લિબાસ (પોશાક) નથી બનાવી ??

અને અમે દિવસને રોજી મેળવવા માટે નથી બનાવ્યો ??

૫. અહ્વાહ તથાલા પોતાની કિતાબ કુરાનમાં ફરમાવે છે :

(અય રસુલ !) તુ કહે કે જો અહ્વાહ કયામતના દિવસ સુધી તમારા માટે સતત દિવસ જ રહેવા દે, તો અહ્વાહ સિવાય બીજો કયો મઅબુદ છે જે તમારા માટે રાતને લઈ આવે જેમાં તમે આરામ કરો ?!? શું તમે આ નથી જોતા ?

અને તેણે જ પોતાના ફ્ઝલથી તમારા માટે રાત અને દિવસ બનાવ્યા છે કે જેથી રાતે તમે આરામ કરો અને દિવસે તેની કૃપા (રોજી) મેળવો, અને એ માટે કે તમે તેનો આભાર માનતા રહો.

૬. અહ્વાહ તથાલા પોતાની કિતાબ કુરાનમાં ફરમાવે છે :

અહ્વાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે સજીવન અને રક્ષણ કરનાર છે, તેને ઝોકુ કે ઉંઘ આવતી નથી.....

૭. અહ્વાહ તથાલા પોતાની કિતાબ કુરાનમાં ફરમાવે છે:

અને તે (અહ્વાહ) એજ છે જે રાત્રે (ઉંઘમાં) રૂહ લઈ દે છે અને દિવસે જે કાર્યો તમે કરી ચૂક્યા છો તેને પણ જાણો છે. પછી તે તમને તે (ઉંઘ)માંથી ઉઠાડી ઉભા કરે છે કે (જેથી જુંદગીનો) નક્કી કરેલો સમય પૂરો

થવા પામે. પછી તેની જ સમક્ષ પાછા ફરવાનું છે. પછી જે કાંઈ તમે કર્યા કરતાં હતા તેનાથી તે તમને વાકેફ કરી દેશે.

૮. અહ્લાહ તથાલા પોતાની કિતાબ કુરાનમાં ફરમાવે છે :

સુખુને રૌશન કરનાર, અને તેણે રાત્રિને રાહત બનાવી અને સૂર્ય તથા ચંદ્રને ગણતરી (માટે) બનાવ્યા, તે અગીઝ અને અલીમની નિર્માણ વ્યવસ્થા છે.

૯. અહ્લાહ તથાલા પોતાની કિતાબ કુરાનમાં ફરમાવે છે :

શું શહેરવાસીઓ આ (વાત)થી નિર્ભય થઈ ગયા છે કે અમારો અજાબ તેમને રાત્રિમાં પકડી લે, એવી સ્થિતિમાં કે તેઓ નિંદ્રાધીન (ઉંઘમાં) હોય ?!

૧૦. અહ્લાહ તથાલા પોતાની કિતાબ કુરાનમાં ફરમાવે છે:

અહ્લાહ તેઓના મૃત્યુ સમયે (તેમના શરીરમાંથી) નફસોને ખેંચી લે છે, અને જેઓનો મૃત્યુ સમય આવ્યો નથી તેમના નફસ તેમની ‘ઉંઘ’ ની હાલતમાં ખેંચી લે છે, પછી જેમના મૃત્યુનો હુકમ (નિશ્ચિત) કરી ચૂક્યો છે, તેમના નફસને રોકી રાખે છે અને બાકીના (નફસ)ને એક ચોકકસ સમય માટે (શરીરમાં) પાછા ફેરવી દે છે. ખરેખર જેઓ વિચાર કરનારા છે તેમના માટે આમાં નિશાનીઓ રહેલી છે.

૨૨. રાત્રે જાગવાના લાભદાયક પ્રસંગો

૧. અલ્લાહના રસૂલ હજુરત મોહમ્મદ (સ. અ. વ.) ફરમાવે છે:

જે શખ્સ ઈદની રાત અને પંદરમી શાબાનની રાત (ઈબાએતમાં) જાગીને પસાર કરે, તેનું દિલ તે દિવસે નહિં મરે, જ્યારે બીજા દિલ મરી જશે.

૨. ઈમામ અલી ઈજ્ઝે અભી તાલીબ (અ. સ.) ફરમાવે છે :

મને એ ખૂબ પસંદ છે કે ઈન્સાન વર્ષમાં આ ચાર રાત્રિઓ દરમિયાન પોતાને અન્ય કામકાજથી દૂર રાખી (જાગતો રહે):

- ઈદુલ ફિત્રની રાત (માહે રમજાન પછીની ઈદ)
- ઈદુલ અઝ્હાની રાત (ઈદ કુરબાન)
- પંદરમી શાબાનની રાત
- પહેલી રજબની રાત

૩. ઈમામ અલી રજા (અ. સ.) ફરમાવે છે :

અમીરુલ મોઅમેનીન (અ. સ.) આ ત્રણ રાત્રિઓ દરમિયાન બિલકુલ સૂતા ન હતા :

- માહે રમજાનની ત્રેવીસમી રાત
- ઈદુલ ફિત્રની રાત (માહે રમજાન પછીની ઈદ)
- પંદરમી શાબાનની રાત

આ ત્રણ રાત્રિઓ દરમિયાન રોગી, ઉમર (વય) તેમજ વર્ષભરના બનાવોની વહેંચણી કરવામાં આવે છે.

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદ

૨. સવારની ઊંઘ એટલે રોજીમાં ઘટાડો

૧. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૫
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૨. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૬
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૩. (એ) તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૬
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
(બી) મન લા યહુરોહુલ ફીહ, ઉર્દુ આવૃત્તિ, ભાગ-૧,
પેજ નંના : ૨૮૫, હદીસ નંના : ૧૪૪૨, શૈખ સદુક (અ. ૨.)
૪. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૫
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૫. મન લા યહુરોહુલ ફીહ, ઉર્દુ આવૃત્તિ, ભાગ-૧,
પેજ નંબર : ૨૮૬, હદીસ નંબર : ૧૪૫૦, શૈખ સદુક (અ. ૨.)

૩. વધારે 'ઉંઘ' ના નુકસાન

૧. તજલીયાતે હીકમત, ઉર્દુ, પ્રકરણ : ૨૧૧, પેજ : ૪૮૭, હદીસ : ૩
૨. તજલીયાતે હીકમત, ઉર્દુ, પ્રકરણ : ૨૧૧, પેજ : ૪૮૭, હદીસ : ૪
૩. તજલીયાતે હીકમત, ઉર્દુ, પ્રકરણ : ૨૧૧, પેજ ૪૮૭, હદીસ : ૬
૪. મીજાનુલ હિકમત, ઉર્દુ આવૃત્તિ, ભાગ - ૧, હદીસ નં. ૫૮૪
૫. તજલીયાતે હીકમત, ઉર્દુ, પ્રકરણ : ૨૧૧, પેજ ૪૮૭, હદીસ : ૭
૬. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪, પેજ નં. ૬૧, હદીસ-૬૭૬૬
૭. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૫૫,
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૮. બિહારુલ અનવાર, ભાગ-૭૭, પેજ નં. ૨૪
૯. બિહારુલ અનવાર, ભાગ-૬૮, પેજ નં. ૧૮૦
૧૦. બિહારુલ અનવાર, ભાગ-૬૨, પેજ નં. ૨૬૨
૧૧. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૫૪
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૧૨. મન લા યહુરોહુલ ફીહ, ઉર્દુ આવૃત્તિ, ભાગ-૧,
પેજ નંબર : ૧૨૨, હદીસ નંબર : ૬૬૪, શૈખ સદુક (અ. ૨.)
૧૩. નહજુલ બલાગાહ, હિકમત-૬૪
૧૪. બિહારુલ અનવાર, ભાગ-૭૩, પેજ નં. ૬૦
૧૫. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૫૫
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૧૬. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૫૫
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)

૪. ઓછી 'ઉંઘ' ના ફાયદા અને ફરીલત

૧. તંબીહુલ ખવાતીર, પેજ નં. ૩૫૬
૨. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ : ૮, પેજ : ૭૧૭, હદીસ : ૧૭૫૮૫
૩. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૧, પેજ નં. ૧૮૮, હદીસ-૬૨૧
૪. તંબીહુલ ખવાતીર, પેજ નં. ૩૬૧
૫. સવાબુલ અભમાલ વ ઈકાબુલ અભમાલ, શૈખ સદુક (અ. ૨.)
૬. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪, પેજ નં. ૮૩૪, હદીસ-૮૬૬૦
૭. સૂરે જારીયાત, આયત નંબર : ૧૫ થી ૧૯

૫. સુવાનો સમય

૧. શર્હ રિસાલતુલ હુક્ક
૨. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૫૮૮

- લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૩. બિહારુલ અનવાર, ભાગ-૩, પેજ નં. ૭૮
 ૪. (એ) તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૬૨
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 (બી) મીજાનુલ હિકમત, ભાગ-૪, પે ૮૭૪, હદીસ-૮૯૬૦
 ૫. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૫
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૬. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ: ૫૮૨, ૫૮૩, ૫૮૪, ૫૮૫
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૭. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ: ૪૮૦

૬. સૂવાની જગ્યા

૧. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૮
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૨. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૯
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૩. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૯
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૪. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૦
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૫. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૪૭૪
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૬. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૫૫
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૭. સવાબુલ અનમાલ વ ઈકાબુલ અનમાલ, ઉર્દુ આવૃત્તિ, લે: શૈખ સદ્ગુ (અ. ૨.)
 પેજ નંબર ૫૭૭, પ્રકરણ : લવાતની સજા, હદીસ : ૧૩,
 ૮. આયતુલ્લાહ સૈયદ અલી હૂસૈની સીસ્તાની સાહેબની
 તવગીબુલ મસાઈલ, મસઅવા નંબર : ૮૨૭
 ૯. તહગીબુલ ઈસ્લામ, પેજ નં. ૩૧

૭. સૂવાની રીત

૧. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૦
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૨. હયાતુલ કોલુબ, ઉર્દુ આવૃત્તિ, ભાગ-૧, પેજ નં. ૭૫૪
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૩. મન લા યહગરોહુલ ફીકીએ, ઉર્દુ આવૃત્તિ, ભાગ-૧,
 પેજ નંબર: ૨૮૫, હદીસ નંબર : ૧૪૪૩, શૈખ સદ્ગુ (અ. ૨.)
 ૪. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૩૦૭
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)

૮. રાત્રે સૂતા પહેલાં...

૧. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૬૬
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૨. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૪૮૮
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૩. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૦
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૪. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૦
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૫. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૭
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
 ૬. તહગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૭
 લેખક : અત્થામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)

૭. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૫૦
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૮. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૮
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૯. સવાબુલ અભમાલ વ ઈકાબુલ અભમાલ, ઉર્દુ આવૃત્તિ, પેજ : ૪૯,
પ્રકરણ : સુરમો લગાવવાનો સવાબ, હદીસ : ૩
૧૦. સવાબુલ અભમાલ વ ઈકાબુલ અભમાલ, ઉર્દુ આવૃત્તિ, પેજ : ૫૩૮,
પ્રકરણ : ભુખ્યો મોઅમીન દોવા છાંસ સંતુપા થઈને ખાવું, હદીસ : ૨
૧૧. મીજાનુલ હિકમત, હદીસ-૨૦૮૩૭
૧૨. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૬૮
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૫, પેજ : ૭૭૮, હદીસ : ૧૧૧૪૬
૧૩. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ, પેજ નં. ૫૦
૧૪. તવંગીબુલ મસાઈલ, મસઅલો : ઉર્દુ, આયતુલ્લાહ સિસ્તાની સાહેબ
૧૫. તવંગીબુલ મસાઈલ, મસઅલો : ઉર્દુ, આયતુલ્લાહ સિસ્તાની સાહેબ

૮. સૂતા પહેલાં પઢવાની દોઆ, જીક્ર અને તિલાવત

૧. સવાબુલ અભમાલ વ ઈકાબુલ અભમાલ, ઉર્દુ આવૃત્તિ, પેજ : ૨૨૩,
પ્રકરણ : દરેક નમાજ પછી અને સુતી વખતે આયતુલ કુરશી પઢવાનો સવાબ, હદીસ : ૧, લેખક : શૈખ સદ્ગુર (અ. ૨.)
૨. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૧
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૩. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૨
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૪. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૨
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૫. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૩
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૬. (એ) તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૪
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
(બી) સવાબુલ અભમાલ વ ઈકાબુલ અભમાલ, ઉર્દુ, પેજ : ૧૩,
પ્રકરણ : સો વખત લા એલાહ ઈલ્લાહ કહેવાનો સવાબ, હદીસ : ૨
૭. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૫
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૮. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૬
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૯. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૪
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)

૧૦. વહેલા ઉઠી શકતું નથી, શું કરતું ?

૧. મન લા યહેજરોહુલ ફીહ, ઉર્દુ આવૃત્તિ, ભાગ-૧,
પેજ નંબર : ૨૬૩, હદીસ નંબર : ૧૩૫૯, શૈખ સદ્ગુર (અ. ૨.)
૨. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૪૦
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૩. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૭૮
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)

૧૧. ઊંઘ આવતી નથી !

૧. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૫૪
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૨. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૭
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)

૩. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૪૦
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૪. સવાબુલ અભમાલ વ ઈકાબુલ અભમાલ, લે : શૈખ સદ્ગુ (અ. ૨.), ઉર્દુ,
પે: ૪૮૮, પ્રકરણ : અરદ્ધ રાત સુધી નમાજે ઈશા ન પઠવાની સજા, હદીસ : ૧
૫. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૫, પેજ : ૮૫૫, હદીસ : ૧૧૪૦૧
૬. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ : ૮, પેજ : ૩૧૨, હદીસ : ૧૬૪૯૭

૧૨. વહેલી સવારે...

૧. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૪૧૧
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૨. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૫૨૫
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૩. દોઆએ સબાહ, નમાજે સુખ્ષે પછી પઠવાની ઈમામ અલી ઈન્ને અખી તાલીબ (અ. સ.) એ તાલીમ ફરમાવેલી દોઆ, જેનો ઉલ્લેખ મફાતીહુલ જીનાન વગરે દોઆઓની કિતાબોમાં મળે છે.
૪. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૫, પેજ નં. ૩૭૭
૫. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૫, પેજ નં. ૩૭૮, હદીસ-૧૦૦૧
૬. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૫, પેજ નં. ૩૭૯, હદીસ-૧૦૦૪
૭. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૬૬
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૮. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૮, પેજ નં. ૭૮૪, હદીસ-૭૮૭૨
(એ) તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૬
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
(બી) મન લા યહીરોહુલ ફીહ, ઉર્દુ આવૃત્તિ, ભાગ-૧,
પેજ નંબર: ૨૮૬, હદીસ નંબર : ૧૪૫૨, શૈખ સદ્ગુ (અ. ૨.)
૯. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪, પેજ નં. ૮૬૭, હદીસ-૮૦૭૩
૧૦. સવાબુલ અભમાલ વ ઈકાબુલ અભમાલ, ઉર્દુ આવૃત્તિ,
પેજ : ૭૮, પ્રકરણ : અચ્ચલ સમયે નમાજે સુખ્ષે પઠવાનો સવાબ, હદીસ : ૧
૧૧. સવાબુલ અભમાલ વ ઈકાબુલ અભમાલ, ઉર્દુ આવૃત્તિ,
પેજ : ૮૮, પ્રકરણ : તબકીબાતે નમાજોનો સવાબ, હદીસ : ૩
૧૨. સવાબુલ અભમાલ વ ઈકાબુલ અભમાલ, ઉર્દુ આવૃત્તિ, પેજ: ૩૪૫,
પ્રકરણ : સહરીના સમયે દોઆનો સવાબ, હદીસ : ૧
૧૩. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪, પેજ નં. ૨૨૮, હદીસ-૭૧૮૦
૧૪. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૧૮૫, ૧૮૬
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૧૫. રૂહુલ હ્યાત (અયનુલ હ્યાત), ઉર્દુ આવૃત્તિ, પેજ નંબર ૪૮૪
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૧૬. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૧૩૫
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૧૭. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૫, પેજ નં. ૪૮૮, હદીસ-૧૦૪૨૮
૧૮. તહંગીબુલ ઈસ્લામ, ઉર્દુ, પેજ નં. ૪૭

૧૩. ઊંઘ અને મૌત

૧. (એ) હ્યાતુલ કોલુબ, ઉર્દુ આવૃત્તિ, ભાગ-૧, પેજ નં. ૫૮૮
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
(બી) મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૭,
પેજ નં. ૮૦, હદીસ-૧૪૪૩૭
૨. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪,
પેજ નંબર ૩૫૬, હદીસ-૭૫૦૪
૩. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪,
પેજ નંબર ૩૫૬, હદીસ-૭૫૦૬
૪. તજલીયાતે હીકમત, ઉર્દુ, પ્રકરણ : ૨૧૧, પેજ : ૪૮૭, હદીસ: ૮

૫. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪,
પેજ નંબર ૩૫૫, હદીસ-૭૫૦૪
૬. સૂરે અન્નામ, આયત નંબર : ૬૦
૭. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪,
પેજ નં. ૫૬ થી ૬૨, હદીસ-૬૭૫૪
૮. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪,
પેજ નં. ૫૬ થી ૬૨, હદીસ-૬૭૫૫
૯. તજલીયાતે હિકમત, ઉર્દુ, પ્રકરણ : ૨૦૦, મૌત, હદીસ : ૧૬

૧૪. ઊંઘમાં ડરી જવું

૧. તહેગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૭૮
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૨. તહેગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૭૭
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૩. તહેગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૭૮
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૪. મન લા યહેગ્રોહુલ ફીહ, ઉર્દુ આવૃત્તિ, ભાગ-૧,
પેજ નંબર: ૨૪૪, હદીસ નંબર : ૧૩૫૮, શૈખ સદુક (અ. ૨.)
૫. તહેગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૮
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૬. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪, પેજ નં. ૬૧, હદીસ-૬૭૬૭

૧૫. રાત્રે ઉજાગરા કરવા, નકામા કાર્યો માટે જાગવું

૧. બિહારુલ અનવાર, ભાગ-૫૫, પેજ નં. ૨૦૭
૨. (એ) તહેગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૫૭
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
(બી) મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪,
પેજ નંબર ૮૩૭ થી ૮૪૦, હદીસ-૮૮૭૧
૩. તહેગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૫૩૩
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૪. તહેગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૫૩
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૫. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪,
પેજ નંબર ૮૩૭ થી ૮૪૦, હદીસ-૮૮૭૨

૧૬. ઊંઘ નશો છે

૧. તહેગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૫૪
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
૨. તહેગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૫૪
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)

૧૭. કૈલુલહ (બપોરની જરામાત ઊંઘ)

૧. (એ) તહેગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૯
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)
(બી) મન લા યહેગ્રોહુલ ફીહ, ઉર્દુ આવૃત્તિ, ભાગ-૧,
પેજ નંબર: ૨૮૫, હદીસ નંબર: ૧૪૪૫, શૈખ સદુક (અ.)
૨. (એ) મન લા યહેગ્રોહુલ ફીહ, ઉર્દુ આવૃત્તિ, ભાગ-૧,
પેજ નં: ૨૮૫, હદીસ નં: ૧૪૪૮, શૈખ સદુક (અ. ૨.)
(બી) તહેગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૨૯
લેખક : અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (અ. ૨.)

૧૮. ઊંઘના પ્રકાર

૧. તહેગીબુલ ઈસ્લામ, ઉર્દુ આવૃત્તિ, પેજ નં. ૨૩૦

૧૯. કયારેક ઊંઘ ઈબાદત કરતા બહેતર હોય છે !

૧. તજલીયાતે હીકમત, ઉર્દુ, પ્રકરણ : ૨૧૧, પેજ : ૪૮૭, હદીસ : ૧
૨. તજલીયાતે હીકમત, ઉર્દુ, પ્રકરણ : ૨૧૧, પેજ : ૪૮૭, હદીસ : ૨
૩. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪,
પેજ નંબર ૮૩૩ થી ૮૪૦, હદીસ-૮૮૬૮
૪. સૂરે બકરહ, આયત નંબર ૨૦૭
૫. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪,
પેજ નંબર ૪૭૮, હદીસ-૭૮૧૨

૨૦. રોજેદારની ઊંઘ

૧. સવાબુલ અભમાલ વ ઈકાબુલ અભમાલ,
ઉર્દુ આવૃત્તિ, પેજ : ૧૦૮, પ્રકરણ : રોજેદારનો સવાબ, હદીસ : ૧
૨. સવાબુલ અભમાલ વ ઈકાબુલ અભમાલ,
ઉર્દુ આવૃત્તિ, પેજ : ૧૦૮, પ્રકરણ : રોજેદારનો સવાબ, હદીસ : ૨
૩. સવાબુલ અભમાલ વ ઈકાબુલ અભમાલ,
ઉર્દુ આવૃત્તિ, પેજ : ૧૧૧, પ્રકરણ : રોજેદારનો સવાબ, હદીસ : ૩

૨૧. કુરાનમાં ‘ઊંઘ’ નો ઉલ્લેખ

૧. સૂરે રૂમ, આયત નંબર : ૨૮
૨. સૂરે નમલ, આયત નંબર : ૮૬
૩. સૂરે ઝુર્કાન, આયત નંબર : ૪૭
૪. સૂરે નબાઅ, આયત નંબર : ૮, ૧૦, ૧૧
૫. સૂરે કસસ, આયત નંબર : ૭૨, ૭૩
૬. સૂરે બકરહ, આયત નંબર : ૨૫૫
૭. સૂરે અન્યાય, આયત નંબર : ૬૦
૮. સૂરે અન્યાય, આયત નંબર : ૮૬
૯. સૂરે અઅરાફ, આયત નંબર : ૮૭
૧૦. સૂરે જુમર, આયત નંબર : ૪૨

૨૨. રાત્રે જાગવાના લાભદાયક પ્રસંગો

૧. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪,
પેજ નંબર ૮૩૩ થી ૮૪૦, હદીસ-૮૮૭૩
૨. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪,
પેજ નંબર ૮૩૩ થી ૮૪૦, હદીસ-૮૮૭૪
૩. મીજાનુલ હિકમત, ઉર્દુ, ભાગ-૪,
પેજ નંબર ૮૩૩ થી ૮૪૦, હદીસ-૮૮૭૫

અલ્લાહુમ સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદ